


॥ तस्य वाचकः पणवः ॥

लता-भरा

आत्मनो हिताय जगतः सुखाय



'योग' लिखा लावीओ, 'लिखु' जनी गुरुद्वार;
मुमुक्षु जड़े पामशे, सौनो मुजमां भाग.

* प. पू. गुरुदेव श्री चोगलिक्षुलनी विदेशयात्रा *

ता. १७-५-६३ ने रविवारे पूज्य गुरुदेव ऐस-हनियानी सवारनी ३-४५ छक्कानी इक्काई द्वारा मुंबईयी अमेरिका ज्वा रवाना यसा. पूज्य श्री विदेशयात्रा हरभ्यान परम वीतन्य ऐसा ओमप्रसादत्मा विषेना ज्ञाननो, योगनो अने आध्यात्मिक ज्ञाननो प्रचार अने प्रसार करणे अने ते द्वारा त्यांना जनसभाज्ज्ञे साची समजाखु प्राप्त कशववानो प्रथल करणे. आ यात्रा हरभ्यान पूज्यश्री मुख्यत्वे श्री भारतसाई देसाईना निवासस्थाने दोळाये.

पूज्यश्रीनी यात्रा शड थर्ड ते पहेलां एक प्रेरणाकांची प्रसंग बन्या

ग. स्व. मंजुणेनी वाढी ठिक्का के पूज्यश्री अमेरिका ज्वां पहेलां मुंबई आतेना तेमना निवासस्थाने पधरामध्यी करे अने मुंबईयी ज अमेरिका ज्य. परंतु पूज्यश्रीनी अमदावाईयी -नुयोर्कनी टिकीट कन्हई थर्ड आ टिकीट ता. २०-५-६३ नी उती. पूज्यश्रीनी इक्काई वहेला ज्वानी उती तेथी डॉ. लिक्षुलुचे आगणना डिवसनी कन्हई टिकीट मगे तेवो प्रथल करो. ता. १७-५-६३ नी टिकीट कन्हई थर्ड परंतु आ डिवसनु खेन डिल्ही-मुंबई-इंडन-न्युयोर्कनु उतु. तेथी पूज्यश्रीने आगला डिवसनी इक्काईतमां अमदावाईयी मुंबई ज्यु पडऱ्यु. मुंबई एरपोर्ट उपर मंजुणेनना लाई गेतानी भार तहने तेडवा आवेला. एरपोर्ट उपरवी पू. गुरुदेव मंजुणेनना वेद गया. मंजुणे तो गदगद थर्ड गया. तेमनी लावना इणी. पूज्यश्रीनी पधरामध्यी थर्ड अने सौने स्वाध्याय-सत्संगनो लाल मज्जे. अस्तु.

शिष्यनी शुद्ध प्रत्येनी निष्ठा, ग्रेम, लावना अने हठयपूर्वकनी प्रार्थना अवश्य रपे छे तेनु आ प्रेरणाकांची घटांत छे.

* गुरुपूर्णिमा भृत्यात्सव *

तारीख : ३-७-१९६३ शनिवार

समय : सवारे ७-०० वाढ्याथी.

स्थल : ठिक्काणेननी वाडी, शेवत शुबन,

महाराष्ट्र, अमदावाई-३८० ००८.

=: अर्वेने हार्दिक आमंत्रण. :=

અદતમભરા

(અદતમભરા એટલે અનુભવચુકત સત્યથી ભરેલું)

(બહુજનહિતાચ - બહુજનસુખાચ)

(ત્રીમાસિક) જુલાઈ-ઓગષ્ટ-સપ્ટેમ્બર

VOL - III (93 - 94)

ISSUE - I

માનદું તંત્રી : નૈષધ વ્યાસ

તંત્રીસ્થાનેથી

વાચક મિત્રો,

આ અંક સાથે “તુલાભરા” નવ વર્ષ પૂરાં કરી દસમા વર્ષમાં પ્રવેશ કરે છે.

આજે એ હિંદુસની યાદ આવે છે -

૧૯૮૪ ના વર્ષમાં ઓ.પ્રે.પ. ટ્રસ્ટની મીટિંગ ડાકોર મુકામે શ્રી ગુરુધાનભિકૃતુણને તાં મળી હતી. શ્રી સદ્ગુરુસમર્પણભિકૃતુણ પણ ઉપસ્થિત હતા. મારી સાથે બીજા ટ્રસ્ટીઓ એ મીટિંગમાં ભાગ લેવા માટે સમયસર હાજર થઈ ગયા.

‘ગુરુમહિમા’ના ગાન બાદ મીટિંગની કાર્યવાહી શરૂ થઈ. એક પણી એક સૌ પોતપોતાના કાર્યની વિગતો આપતા હતા. હું ધ્યાનથી સાંભળતો હતો. સાંભળવા સિવાય તથા તે ચર્ચાઓ ઉપર થોડું વિચારીને પ્રેરણ લેવા સિવાય મારે બીજું કાઈ કરવાનું નહોંતું. મારી નાની ઉમર તથા ટ્રસ્ટના કાર્યનો બહોળો અનુભવ નહીં. આ કારણે ભિકૃતુણની વાતો સાંભળીને પ.પૂ. ગુરુદેવ શ્રી યોગભિકૃતુણના સિદ્ધાંતોને-આદર્શોને સમજવાની કોશિષ કરી રહ્યો હતો. શ્રી સદ્ગુરુસમર્પણભિકૃતુણએ પૂ. ગુરુદેવના “આત્મનો ડિતાપ જગત: સુખાય” ના કાર્યક્રમની વિગતવાર ચર્ચા કરી અને ગુરુદેવના તાત્ત્વિક-ભૌતિક વિચારોના પ્રચાર અને પ્રસારને વધુમાં વધુ વેગ મળે તે અંગે સૌને સૂચનો કરવા હતું.

‘પૂજયશ્રીની ટિવ્ય વાણી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે પ્રસંગોપાત્ર પુસ્તકોનું પ્રકાશન કરવું અને તેનો વધારોઘ્ય પ્રચાર-પ્રસાર કરવો’ - લગભગ દરેક ટ્રસ્ટીનું આ સૂચન હતું.

સૌ પોતપોતાનાં સૂચન રજૂ કરતા હતા ત્યારે હું શુન્યમનસ્ક બેઠો હતો. ત્યાં સમર્પણભિકૃતુણનો અવાજ મારા કાને અથડાપો, “તમારું શું સૂચન છે નેપથનાઈ ?” મારા મૌખાંથી અચાનક નીકળી ગયું -

“પુસ્તકોનું પ્રકાશન થાય તે તો ખૂબ આનંદની વાત છે અને તેમાં સૌનો એકમત છે જ; તેથી પ્રકાશનના કાર્યને અને તેમાં પ્રકાશિત થતા પૂજયશ્રીના સાહિત્યના પ્રચાર-પ્રસારને વેગ મળશે જ. પરંતુ સાથે સાથે એકાદ નાનું સામયિક પ્રગટ થાય તો પૂજયશ્રીના વિચારોને ખૂબ જરૂરથી ઘડો દૂર સુધી વિસ્તારી શક્ય અને લોકોને ઓમ્બુ પરિવરતના અને ઓ.પ્રે.પ. ટ્રસ્ટના કાર્યોથી વાકેફ કરી શકાય.

બધા ટ્રસ્ટીઓએ આ વાતને વધાવી લીધી. પરંતુ પ્રશ્ન એ ઊભો થધો કે સામયિકનું સંપાદનકાર્ય કોણ સંભળાયે ? ધ્યાનભિકૃતુણ અને સમર્પણભિકૃતુણએ મારા તરફ ઈશારો કરી કહ્યું કે, “તમે જ સામયિકનું સંપાદનકાર્ય સંભળો.” હું ગભરાપો. કારણ કે હું વિશ્વાનશાખાનો સ્નાતક; વળી સામાન્ય સાહિત્યનું પણ શાન નહીં, તો આ તો આધ્યાત્મિક સાહિત્યનું સંપાદનકાર્ય ! પરંતુ ઉત્સાહ ખૂબ હતો. તેથી મનોમન ગુરુદેવને-પરમાત્માને પ્રાર્થના કરીને આ કાર્ય લાખમાં લીધું.

મીટિંગ પતાવા બાદ ડાકોરથી અમદાવાદ આવ્યો. પૂજયશ્રીને મીટિંગમાં ઘેરેલી ચર્ચાઓની વિગતે વાત કરી. પૂજયશ્રીએ પણ સામયિક પ્રગટ કરવાના વિચારને પ્રેમપૂર્વક વધાવી લીધો. પ્રથમ અંકની હસ્તલિખિત પત્ર તૈયાર કરવામાં તેમણે ખૂબ મદદ કરી. પ્રથમ અંકનું સંપાદનકાર્ય ચાલુ હતું

તે દરમાન ઓ.પ્રે.પ. ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ અને ઓમૃ પરિવારના સ્વપંસેવકોએ, સામાન્યમાં સામાન્ય માણસથી માંડીને વિચકાશમાં વિચકાશ માણસોનો સંપર્ક સાથો અને આ રીતે "બહુજનહિતાય-બહુજનસુખાય"ના આ કાર્યમાં ઘણા માણસો જોડાયા.

જુલાઈ ૧૯૮૮ માં પ્રથમ અંક "પરિવાર-પનિકા" ના નામે પ્રગટ થયો. પ્રથમ અંકને વાચકોનો ખૂબ સહજાર પ્રામ થયો. ઘણા બધાએ પત્રો દ્વારા પ્રેરણાદારી અભિપ્રાયો મોકલાવ્યા, વરીલ વાચકોએ સામયિકની સફળતા માટે શુદ્ધેશ્વા-આશિષ પાઠવ્યા.

પ્રથમ અંકની સફળતાએ મારામાંની લયની લાગણીને ઓછી કરી. ત્યારબાદ સંપાદનનું આ કાર્ય પીરે ધીમે કોડે પરી રહ્યું, વાચકોનાં સલાહ-સૂચનોએ પણ આમ થવામાં થણી મદદ કરી. કે વર્ધમાં આઈ અંક "પરિવાર-પનિકા"ના નામે પ્રગટ થયા. ત્યારબાદ સામયિકનું નામ બદલીને "રૂતમલા" રાખ્યું.

છીલ્લા નવ વર્ષમાં આ સામયિકમાં પિરસાતા આધ્યાત્મિક સાહિત્ય દ્વારા અનેક વાચકોએ અંધશ્રદ્ધામાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કર્યો, યોગના સાધક બનવાનો પ્રયત્ન

કર્યો,

આજે જ્યારે 'રૂતમલા' દસમા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી યોગભિમુજ્જને સાણંગ દંડવત્ પ્રષાંત કરી હું નામપણે વિનંતી કરું હું કે પૂજ્યશ્રી તેમની વાણીગંગાને અવિરતપણે વહાવ્યા કરે અને તે દ્વારા મારા જેવા નાલાયક મનુષ્યને લાયક બનવાની પ્રેરણ આપે. આ પ્રસંગે ઓ.પ્રે.પ. ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો, ઓમૃપરિવારના સ્વપંસેવકોનો અને તમામ વાચક મિત્રોનો હું આભાર માનું હું કારણકે તેમની મદદ દ્વારા જ ગોઠણિયે ચાલતું આ સામયિક આજે હરણકાળ બરી રહ્યું છે.

અને હેઠ્લે -

સમગ્ર વાચકગણને અને ગુરુભાઈબહેનોને 'રૂતમલા'ના આ દશાખ્ટી વર્ષ (જુલાઈ-લું થી જૂન-લું)નિયતી આગ્રહભરી નમ્ર વિનંતી કે તેઓ આ સામયિકમાં પ્રગટ થતા સાહિત્યનો વધુમાં વધુ પ્રચાર કરે અને તે દ્વારા લોકોને સાચી સમજજ્ઞ પ્રામ કરાવવામાં મદદ કરે. "જે જે સાચી સમજ પમાપ તે તે ગુરુપૂજન ગણાય, જે જે હુર્ગુંશ છૂટી જાય તે તે પ્રભુભજન ગણાય." અસ્તુ,

શાંતા

- યોગભિમુજ્જ

(પાતંજલ યોગદર્શન - સાધનપાદ)

પાતંજલ યોગદર્શનના સમાધિપાદની ગુજરાતી ટીકાનું નામ 'મુક્તા' રાખ્યું, જે મુક્ત થવામાં મદદ કરે તે 'મુક્તા'. સમાધિપાદની ટીકા 'રૂતમલા' ના અગાઉના અંકોમાં પ્રગટ થઈ ગઈ છે.

પાતંજલ યોગદર્શનના સાધનપાદની ટીકાનું નામ 'શાંતા' રાખ્યું છે. શાંત થવામાં - પરમ શાંતિ પ્રામ કરાવવામાં જે મદદ કરે તે 'શાંતા'. પારમાર્થિક રીતે જોતાં 'શાંતા'નો અર્થ પણ 'મુક્તા' જ થાય છે. આલ્યાંતિક સુખની પ્રાપ્તિ થાય ત્યારે જ સાચી શાંતિ મળે છે. એવી શાંતિને મુક્તિ જે

કહેવાય, ભગવાનના સ્વરૂપ વિષે પણ કહેવાયું છે કે "શાંતાકાર" અર્થાત् શાંત આકૃતિવાળા.

શાંત અર્થાત્ સારી રીતે અંત આવી ગયો છે જેના દુઃખોનો તેવા સારી રીતે એટલે અચૂકપણે અને સંપૂર્ણપણે.

સાધનાનો માર્ગનું કરતાંની સથે જ એક એવી સંતોષ પ્રવર્તિવા લાગે છે; જેથી એમ લાગે છે કે જાણે આપણે પણ કંઈક કરી રહ્યા છીએ. કલ્યાણપથના પચિક બન્યા છીએ તો જરૂર ક્યારેક શાંતિમંદિરમાં પહોંચી જઈશું.

નિયમિત સાધના કરનાર, જીવનબ્યવહારનાં બીજાં કાર્યો કરતો હોયા છતાં પણ પોતાના જીવનને લખું-ભરું અનુભવે

છ. કેમકે તેણે પંથ કાપવાની શરૂઆત કરી દીધો છે. તેથી પંથ બલે જગે તેટલો લાંબો હોય તો પણ તે પૂરો થવાનો જ. આવી શક્તા તેના ઉત્સાહને સતત બળ આપ્યા કરે છે. અને આ રીતે શાંતિના જબકારા દસ્તિગોચર થવા લાગે છે. સાધના દ્વારા શાંતિનો સાક્ષાતું અનુભવ થતાં પૂર્વ જ, સાધનાના આરંભથી જ, શાંતિ પોતાની કમાલ દેખાડવા લાગે છે !

યોગદર્શનના ગ્રીજા પાદનું નામ છે વિભૂતિપાદ. વિભૂતિ એટલે સિદ્ધિઓ-એશ્વર્યો. સૌને સિદ્ધિઓ જોઈએ છે. અધિકાર પ્રામ કર્યા સિવાય સિદ્ધિઓ પ્રામ કરવા ગાંડા થઈને દોટ મુકે છે, ત્યારે સિદ્ધિઓ તેનાથી અત્યંત દૂર ભાગે છે. ‘ત્યાગે તેની આગે અને માગે તેનાથી ભાગે’ એ ન્યાયે સિદ્ધિઓ-વિભૂતિઓ વર્તે છે. ગુરુપ્રેમલિખિતુછ (અમેરિકા) કહે છે ને કે ‘આપ્યા વિનાની અપેક્ષા એ તો નર્યું ગાંડપણ છે, નરી મૂર્ખતા છે.’

મુક્તિ અને શાંતિ પ્રામ કરી ચૂકેલ વક્તિ પાણે સિદ્ધિઓ હાથ જોડીને ઊભી રહે છે. પરંતુ તેમને સિદ્ધિઓની બિલકુલ જરૂરત નથી. મુક્તિ અને શાંતિ ઊચામાં ઊચી પ્રામિ છે. હંમેશા-હંમેશા માટે દુઃખોથી મુક્ત થઈ જવું તે મુક્તિ. અને હંમેશા-હંમેશા માટે દુઃખોનો અંત આવી જવો તે શાંતિ. કોઈપણ પ્રકારનાં સ્થળ ભૌતિક સિદ્ધિ-એશ્વર્યો મેળવીને શું કરવા હશીઓ છીએ ? તેનાથી સાચાં સુખશાંતિ જ બોગવવાની હશી હોય છે ને ? પણ જો સીધેસીધાં જ સુખશાંતિ મળી જતાં હોય તો વચ્ચે કોઈ બીજા માધ્યમની શી જરૂર છે ? વિભૂતિપાદનો કમ ગ્રીજો છે તેનું કારણ પણ એ જ છે કે સમાપ્તિ અને સાધના દ્વારા યોગ્યતા પ્રામ કરીને જ વિભૂતિપાદમાં પ્રવેશવાનો અધિકાર મેળવવાનો છે. પરંતુ એ અધિકાર પ્રામ કરવાના પ્રયત્નમાં ‘કંઈક એવું’ પ્રામ થઈ જાય છે કે જેના દ્વારા વિભૂતિઓમાંથી મોહ-આકર્ષણ-પ્રલોભન ચાલ્યું જાય છે. એ જે પ્રામ થાય છે તેનું વર્ણન શાંદોમાં કરી શકાતું નથી. જ્યારે સિદ્ધિઓમાંથી સમજપૂર્વક આકર્ષણ દૂર થાય ત્યારે સમજવું કે ‘કંઈક એવું’ પ્રામ થઈ ગયું છે. પારસ્પા, ધ્યાન અને સમાપ્તિવૃદ્ધિ ‘સંયમ’ દ્વારા સિદ્ધિઓની પ્રામિ થાય છે એ જ કહી આપે છે કે સમાપ્તિ સુધીનો અધિકાર પ્રામ કર્યા પછી જ સિદ્ધિઓમાં પ્રવેશ થઈ શકે છે. સાધનપાદ અર્થાતું સાધના એ અતિ મહત્વનું અંગ છે. જો સાધના ના હોય તો સમાપ્તિ, વિભૂતિ કે તેવલ્ય

એકેધની પ્રામિ કે અનુભૂતિ થતી નથી.

‘નથી દીપાં કથીરોનાં દાન, કંચન ક્યાંથી પામીએ ?’ મનુષ્ય જ્યારે આપ્યા સિવાય લેવાની હશી કરે છે, અધિકાર સિવાય પ્રામિની અભિલાઘા સેવે છે ત્યારે તે હાસ્યાસ્પદ રીતે નિર્ઝળ જાય છે. તે વાતને મનોરંજન સાથે આ રીતે સમજું :

એક વક્તિને સિદ્ધિદેવીએ સ્વપ્રમાં દર્શન આપ્યાં. તે દેવીની એડી અને માથાનો ભાગ ઘસાઈ ગમેલો હતો. તે જોઈને તે મનુષ્યને આશર્ય થયું. તેણે પૃથ્વીનું, ‘દેવીજી ! આમ કેમ ?’ દેવીજાને જવાબ આપ્યો, ‘અનઅધિકારીઓ મને મેળવવા માટે મારી પાછળ એટલા અને એવા લાગેલા રહે છે કે તેમને દૂર કરવા માટે લાતો મારી મારીને મારા પગની એડી ઘસાઈ ગઈ છે. અને મારો સ્વીકાર કરાવવા માટે અધિકારીઓનાં શરણોમાં માધું રગડી-રગડીને માધું માધું ઘસાઈ ગયું છે.’

અતિ શાંત અને ધીરગંભીર કાશોમાં યોગસ્તુતો ઉપર જે કંઈ સ્કુરણાઓ સ્કુરી, વિશ્વેતનામાંથી જે કંઈ પ્રેરણાઓ પમાણી તથા સાધનાકાળ દરમાન સ્વાનુભવયુક્ત જે કંઈ ચિંતન-મનન અને નિદિધ્યાસન થયું તેનો નિયોડ ‘શાંતા’ સ્વરૂપે અહી લિપિલદ્ધ થઈ રહ્યો છે. બજનમાં ગાય છે : ‘શાંતિ પમાડે તેને રે સંત કહીએ.’ સંતો પાસેથી જ શાંતિ મળી શકે છે. ‘શાંતિ’ શબ્દ કરતાં ‘શાંતા’ શબ્દ ખૂબ લયોલયો અને શક્તિયુક્ત લાગે છે. શાંતાનો અર્થ છે શાંતિને આપવાચણું, શાંતિથી બરેલું. જેમાંથી શાંતિ બધાર ઉલરાઈ રહી છે તેવું.

આ ‘શાંતા’નું ચિંતન-મનન અને નિદિધ્યાસન કરનારાઓને શાંતિલાભ થાઓ એટલું જ નહીં પરંતુ માત્ર તેનો સ્પર્શ કરનારાઓને પણ ઓમ્ફ પરમાત્મા શાંતિલાભ કરાવો. અસ્તુ.

પાતંજલ યોગદર્શન - સાધનપાદ

તપ: સ્વાધ્યાયેશર પ્રશિદ્ધાનાનિ ડિયાયોગ: || ૧ ||

ભાવાર્થ : તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રશિદ્ધાનને ડિયાયોગ કરે છે.

વિસ્તાર : અષ્ટાગ યોગમાં તપ, સ્વાધ્યાય અને

ઈશ્વરપ્રણિધાનને કિયાયોગ કહેવામાં આવે છે. આ જ્ઞાનનું સામૃહિક નામ કિયાયોગ છે. અન્ય માનાત્માઓ દ્વારા પણ 'કિયાયોગ' શાન્દ પ્રચારમાં આવેલો છે. પણ અહીં તો કિયાયોગ એટલે તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન જ સમજવાનાં છે. કિયાયોગ કહેવાથી કોઈપણ ચોક્કસ પ્રકારની કિયા કરવાની સૂચના પ્રાપ્ત થાય છે, કોઈ કિયા કરવાનો યોગ કરવાનો છે, સ્થૂળ-સૂક્ષ્મ, લૌકિક-અલોકિક કિયા સાથે યોગ કરવાનો છે.

તપ : તપનો અર્થ ખૂબ ઝીંકવટથી અને વ્યાપક રીતે સમજવાનો છે. આ તપ અધાંગ યોગમાં આવતું 'તપ' છે. યોગની પહેલી શરત એ છે કે બધું જ 'યુક્ત' થધું જોઈએ, કાર્યપણ 'અતિ' થવું ન જોઈએ. આ જગ્યાએ તપ એટલે કોઈ ઉત્ત્ર કિયાના આચરણની વાત સમજવાની નથી, રજી: પ્રધાન કે તમઃપ્રધાન તપ પણ સમજવાનું નથી; સંપૂર્ણ સત્ત્વમય તપ સમજવાનું છે. યોગસાધના જીવન માટે છે તેથી તે જીવનસાધના પણ છે. તેથી જીવનસાધના અને યોગસાધના કરનારાએ તપને પોતાની દિનચર્યા અને જીવનચર્યામાં ઓતપોત કરી દેવાનું છે. કોઈ અત્યંત કાદાપક કિયાઓ કરવાની નથી. જેમકે વધાબધા ઉપવાસ કરવા, પંચપૂર્ણી તાપવી, એક પગે ઊભા રહેવું, એક હાથ ઊચો કરીને સૂક્ષ્મવી નાખવો વગેરે પ્રકારનાં બયંકર ઉત્ત્ર તામસિક-રાજસિક તપ જોવામાં આવે છે તેવું તપ નથી કરવાનું. અહીં તો સૌભ્ય, સાત્ત્વિક અને અંદર તપ કરવાનું છે.

જીવનમાં આરોગ્ય અતિ મહત્વાનું છે. આરોગ્ય કાપમ જળવાઈ રહે તે માટેના જે નિયમો તેનું પ્રામાણિક પાલન કરવું તે પણ તપ છે. આરોગ્ય માટે નિત્ય, નિયમિત આસન તથા પ્રાણાયામરૂપી બાધ્ય તથા આંતરિક વ્યાપામ કરવો તે પણ તપ છે. શાસ્ત્રોમાં તો પ્રાણાયામ અને બ્રહ્મચર્યને શ્રેષ્ઠ તપ કહેવામાં આવ્યાં છે. જેમ પાતુને તપાવવાથી તેનો મળ નાશ પામી જાય છે તેમ પ્રાણાયામરૂપી તપ કરવાથી શરીરની નાડીઓનો મળ નાશ પામી જાય છે અને નાડીઓ વિશુદ્ધ થઈ જાય છે. બ્રહ્મચર્યરૂપી તપથી દેવોએ મૃત્યુને મારી નાખ્યું એમ વેદોમાં કર્યું છે. આહાર, વિહાર, તથા નિત્રને નિયમમાં રાખી, પરનિદ્રા પરિત્યાગી, ગુણગ્રાહી થઈ પોતાના કુટુંબ, સમાજ અને દેશ માટે અદ્વિતીય દાયાંત બનવું તે પણ અતિ ઉત્તમ તપ છે. યોગનું તપ એ કાંઈ પ્રદર્શનની વસ્તુ નથી. તે

તો ગુપ્તપણે આચરવાની કિયાઓ છે અને તો જ તે સંપૂર્ણ કણદાતા બની શકે છે.

કિયાયોગનું બીજું અંગ સ્વાધ્યાય છે.

સ્વાધ્યાય : સ્વાધ્યાય એટલે 'સ્વ'નો અધ્યાય અને સ્વ એટલે આત્મા-જીવાત્મા-પ્રણા. આત્મા માટે જે કાંઈ કરીએ તેને સ્વાધ્યાય કહેવાય. 'પર'માંથી મુક્ત થઈને 'સ્વ'માં સ્થિર થવા માટે જે કાંઈ સહાયતા કરે તે બધાંને સ્વાધ્યાય કરી શકાય. જુદાં જુદાં અધ્યાત્મમંડળો દ્વારા સ્વાધ્યાયમાં સ્થિર થવા માટે જુદા જુદા કાર્યક્રમોની સહાયતા લેવામાં આવે છે. વિધવિષ બજનો, શ્વોડો, સોંગો, સુતિ, પ્રાર્થના વગેરે બોલીને સ્વાધ્યાય કરવામાં આવે છે. પરંતુ તે સાક્ષાત્ સ્વાધ્યાય નથી, તે સ્વાધ્યાયમાં સહાયતા કરનાર કાર્યક્રમ છે. એ કાર્યક્રમ પણ જો 'સ્વ'માં સ્થિર થઈ શકીએ તો જ ખરો સ્વાધ્યાય થયો કહેવાય. સ્વાધ્યાય માટે - 'સ્વ'માં સ્થિર થવા માટે મંત્ર પણ એક અતિ ઉપયોગી સાધન છે. મંત્રો પણ અનંત છે.

સ્વાધ્યાય માટે ગાયત્રીમંત્ર ખૂબ સહાયક છે. અમે સ્વાનુભવપૂર્વક કહીએ છીએ કે દીર્ઘકાળ, નિયમપૂર્વક ગાયત્રીમંત્રના જપ કરવાથી બુદ્ધિમાં પણ સૂક્ષ્મતા આવે છે અને તેથી અતિ સૂક્ષ્મ વિષયોને સમજવાની પોત્યતા પ્રાપ્ત થાય છે. આવી પોત્યતા પ્રાપ્ત થવાથી પદ્ધાર્થ દર્શનની પ્રાપ્તિ થાય છે અને તેથી 'સ્વ'માં સ્થિર થઈ શકાય છે. પ્રાણાયામ અને બ્રહ્મચર્યના પાલનરૂપી તપથી સૂક્ષ્મ થયેલું તન-મન 'સ્વ'માં સ્થિર થવા માટે પણ ક્ષમતાવાળું હોય છે.

આત્મતત્ત્વ વિષેની બધા પ્રકારની સમજણી પ્રાપ્ત કરી લેવી તેનું નામ સ્વાધ્યાય.

હવે ઈશ્વરપ્રણિધાનને સમજાઓ.

ઈશ્વરપ્રણિધાન : ઈશ્વરપ્રણિધાન એટલે ઈશ્વરને શરણે જરૂર, અહંકારનો સંપૂર્ણ લય. જીવન જીવન માટે જે જે કર્તવ્ય-કર્મો કરવાં પડે તે તે ફળની ઠંચા વિના થાય. મનને ગમતું કે અણાગમતું જે કાંઈ કણ મળે તે ઈશ્વરનું જ આપેલું છે અને તેનાથી આપણું બલું જ ધ્વાનું છે તેવી સમજણાનું હોવું તેનું નામ ઈશ્વરપ્રણિધાન. ઉપરોક્ત તપ અને સ્વાધ્યાય દ્વારા બુદ્ધિ પરિમાર્જિત થવાથી નિષ્કામ કર્મયોગનું આચરણ થઈ શકે છે. ઈશ્વરસમર્પણની રીતે જે જીવ છે, લાભ અને નુકસાનની તેની વ્યાખ્યા સામાન્ય

મનુષનો વ્યાખ્યા જેવી નથી હોતી. સામાન્ય મનુષો પોતાના મનનું ધાર્યું કરવા હશ્ચતા હોય છે; જ્યારે ઈશ્વરપ્રણિધાનવાળા સાથકો કર્મનું જે કાંઈ કણ મળે તેને ઈશ્વરનું આપેલું જ સમજે છે અને જે ઈશ્વરનું આપેલું છે તે કલ્યાણકારી જ હોય એમ સમજે છે.

પતંજલિ મુનિને ઈશ્વરપ્રણિધાનનો મહિમા સમાધિપાદમાં પણ કહ્યો છે. સમાધિપાદના સૂત્ર તેવીસમાં તેમણે કહ્યું - ઈશ્વરપ્રણિધાનાદા અર્થાત् “અથવા તો ઈશ્વરની શરણાગતિથી (અસંપ્રકાત યોગની પ્રાપ્તિ થાય છે).” જેને અસંપ્રકાત યોગ જન્મથી પ્રાપ્ત નથી અને જે ઉપાયથી પણ મેળવી શકે તેમ નથી અને છતાંય પ્રાપ્ત કરવાની હશ્ચા રાખે છે તેણે તે પ્રાપ્ત કરવા ઈશ્વરની શરણાગતિ સ્વીકારી લેવી. આ ઉપાય આમ તો બહુ સહેલો લાગે છે કે “ઓહ ! આમાં શું ? આ તો બહુ સરસ ! માત્ર ઈશ્વરશરણે ચાલ્યાં જઈશું એટલે અસંપ્રકાત યોગ પ્રાપ્ત થઈ જશે.” આમ બોલવામાં તો સરણ લાગે છે. જો કે તે અતિ સરળ પણ છે અને મહાકઠિન પણ છે. શરણાગતિ સ્વીકારતાં આવડે તો અતિ સરળ છે. પરંતુ તે આવડત કેવળવી એ કઠિન છે. જીવનમાં ઘણુંબધું સમાધાન પ્રવર્તતનું હોય તો જ ઈશ્વરની શરણાગતિ સ્વીકારી શકાય છે, તો જ ઈશ્વરના શરણે જઈ શકાય છે, તો જ “ભેસનો પગ ભાંઝ્યો તો સારા માટે” એમ કહી શકવાની હિંમત કરી શકાય છે.

અસંપ્રકાત યોગનું જ્ઞાન જેઓને જન્મથી જ હોય છે તેમણે પણ તે, ગતજન્મોમાં અભ્યાસ કરીને જ પ્રાપ્ત કરેલું હોય છે. તેથી ખરેખર તો એ પણ ઉપાયથી જ પ્રાપ્ત થયેલું જ્ઞાન કહેવાય. આ દિલ્લિએ જોતાં અસંપ્રકાત યોગનું જ્ઞાન પ્રાપ્ત કરવાની બે જ રીતો થઈ કહેવાય. પહેલી ‘ઉપાય’ અને બીજી ‘ઈશ્વરપ્રણિધાન’. પહેલી રીતના ઉપાયમાં પ્રયત્ન, પુરુષાર્થ અને બુદ્ધિ આવે છે; તો બીજી રીતના ઉપાયમાં શ્રદ્ધા, સમર્પજી અને શરણાગતિ આવે છે. ઉપલક દિલ્લિએ જોતાં બંને રીત ભિન્ન લાગે છે પરંતુ સૂક્ષ્મ દિલ્લિએ વિચાર કરતાં સમજાય છે કે શ્રદ્ધા-સમર્પજી-શરણાગતિને સ્વીકારી-અપનાવી લેવાનું પણ ઓછી બુદ્ધિથી અશક્ય છે. સમર્પજી માટે પણ અહમુના સંપૂર્ણ ત્યાગની જરૂરત પડે છે; અને અહમુના સંપૂર્ણ ત્યાગ માટે અતિ સૂક્ષ્મ-શુદ્ધ બુદ્ધિની જરૂરત પડે છે.

જુલાઈ-૮૩

અહમુના વિસર્જન સિવાય ઈશ્વરપ્રણિધાન થઈ શકે નહીં; અને અહમુનું વિસર્જન ઘણાં વર્ષો અને જન્મોના સાધના-અભ્યાસનો પરિપાક છે. અહમુનું વિસર્જન એ પણ એક મોટી સાધના - એક મોટી પ્રાપ્તિ છે. અહમુના વિસર્જનથી ઈશ્વરશરણાગતિ સ્વીકારી શકાય છે અને શરણાગતિ સ્વીકારવાથી રહ્યો-સહ્યો અહમુ પણ વિલય પામી જાય છે.

“આપણું કલ્યાણ કઈ રીતે થશે તે માટે જો આપણી બુદ્ધિ ન ચાલતી હોય તો યોગ્ય વિકિત આપણને આપણા કલ્યાણ માટે જે કાંઈ કરવાનું કહે તે પ્રમાણે આચરણ કરવામાં શ્રદ્ધા રાખવી જોઈએ.” આ વાક્યમાં એક અટપઢું રહસ્ય ઊપર્સી આવે છે કે “હું બુદ્ધિ વિનાનો શું” એટલું જાણવું એ તો ઘણી બધી બુદ્ધિ હોવાનું સાબિત કરે છે ! અને શરણાગતિ સ્વીકારવામાં તો બુદ્ધિને પૂર્ણપણે બાદ કરી નાખવી પડે છે. અને બુદ્ધિને બાદ કરવામાં પણ બુદ્ધિનો જ ઉપયોગ થતો હોય છે ! વળી શરણાગતિનો નિર્ણય પણ મંદબુદ્ધિની વિકિત નથી લઈ શકતી.

ઉપરોક્ત તાત્ત્વિક વિચારણાથી એ જ્ઞાનાં કે ઉપાય-પ્રત્યક્ષ અને ઈશ્વરપ્રણિધાન બંને રીતો ઊડાણમાં જતાં એક છે. ચાહે શ્રદ્ધા દારા બુદ્ધિ તોડો અથવા બુદ્ધિ દારા શ્રદ્ધા જોડો; કે અભ્યાસ દારા અહમુને હટાગ્યો અથવા સમર્પજી દારા અભ્યાસને બઢાઓ. અસ્તુ,

તો, ડિલ્લિયોગનું ગીજું અંગ ઈશ્વરપ્રણિધાન-ઈશ્વરશરણાગતિ છે. તે અસંપ્રકાત યોગ પ્રાપ્ત કરવાનો પણ એક ઉપાય છે. તેથી તેને તાત્ત્વિક રીતે સમજાયા.

ઈશ્વરને શરણે જવું હોય તો ઈશ્વરના કાંઈ ઓળખ-પરિયથ હોવાં જોઈએ. બિલકુલ પરિયથ વિના ઈશ્વરના શરણે કઈ રીતે જઈ શકાય ? ઈશ્વરનું મુખ્ય નામ શું ? તેમની સાચી ઓળખ શું ? તે માટે યોગશાલના સમાધિપાદમાં સૂત્ર રણ થી સૂત્ર રણ આપેલાં છે. (ઈશ્વરની વ્યાખ્યા માટે “ઈશ્વર કોને કહી શકાય ?” અથવા “મુક્તા” પુસ્તક જોઈ લેવું.)

તો, આ રીતે આપણે ડિલ્લિયોગનાં ત્રણ અંગો-તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનને સમજાયા. આ ત્રણનું પ્રયોજન શું છે તે બીજા સૂત્રમાં કહે છે.

સમાધિભાવનાર્થ: કલેશતનુ કરણાર્થશ ॥૨॥

ભાવાર્થ : (કિયાયોગ) સમાધિની પ્રાપ્તિ માટે અને કલેશોને તનુ કરવા માટે (છે).

વિસ્તાર : કિયાયોગનું આચરણ કરવાથી સમાધિની પ્રાપ્તિ થાય છે, સમાધિ સુધી પહોંચી શકાય છે અને કલેશોને તનુ-પાતળા કરી શકાય છે, કલેશોને હટાવી શકાય છે. જ્યાં સુધી કલેશોને તનુ ન કરી શકાય ત્યાં સુધી સમાધિમાં જઈ ના શકાય. તેથી પ્રથમ કાર્ય છે કલેશોને તનુ કરવાનું. કિયાયોગનું મુખ્ય કાર્ય કલેશોને તનુ કરવાનું છે. કલેશો જ્યારે તનુ થઈ જાય છે ત્યારે સમાધિની પ્રાપ્તિ સરળ થઈ જાય છે. કિયાયોગનું પાલન કરવાથી કલેશો તનુ થઈ જાય છે, પાતળા પડી જાય છે અને તેથી સમાધિ માટે જેટલી એકાગ્રતા જરૂરી છે તેટલી એકાગ્રતા પ્રાપ્ત થાય છે. કલેશો કે જે શાંતિપ્રાપ્તિ માટે મોટામાં મોટા બાધક છે, મનુષ્યની શાંતિને છિન્નબિન્ન કરી નાખે છે, સાધકની શાંતિને ડાંબોની નાખે છે - તેનું વર્ણન યોગશાલામાં બહુ સારી રીતે કરેલું છે.

સમાધિપાદમાં જેમ પાંચ પ્રકારની વૃત્તિઓનું વર્ણન વિસ્તારપૂર્વક કરેલું છે તેમ આ સાધનપાદમાં પાંચ પ્રકારના કલેશોનું વર્ણન પણ વિસ્તારપૂર્વક કરેલું છે. પાંચ પ્રકારના જે કલેશો વર્ણિત છે, તેમને તનુ-પાતળા કરવા માટે, તેમનો નાશ કરવા માટે, તેમને હટાવવા માટે કિયાયોગનું આચરણ કરવાનું છે. એ કલેશો જ્યારે સૂક્ષ્મ થઈ બરાબર નાશ પામી જાય ત્યારે સમાધિની પ્રાપ્તિ થાય છે.

પાંચ પ્રકારના કલેશો કયા કયા છે, તેમના નામ શું શું છે તેની વાત ક્રીજ સૂત્રમાં આવે છે.

અવિદ્યાઅસ્મિતા રાગદેપાલિનિવેશા : પંચ કલેશા : ||૩||
ભાવાર્થ : અવિદ્યા, અસ્મિતા, રાગ, દેખ અને અલિનિવેશ ; આ પાંચ પ્રકારના કલેશો છે.

અવિદ્યાસેત્રમુત્તરેષાંપ્રસુપ્તતનુવિચ્છનોદારાશામૃ ||૪||

ભાવાર્થ : (ઉપરોક્ત) કલેશોને પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર નામવાળી ચાર અવસ્થાઓ છે અને તેમનું કેત્ર અવિદ્યા છે.

વિસ્તાર : પાંચ પ્રકારના કલેશો વિષે હવે વધુ સમજાવ આપી રહ્યા છે. તેની કેટલી અવસ્થાઓ છે ? પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર, આ ચાર અવસ્થામાં રહેલા કલેશોનું કેત્ર-ખેતર અવિદ્યા છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દેખ અને જુલાઈ-૮૩

અલિનિવેશ એ પાંચ તો કલેશો છે પરંતુ તેનું કેત્ર કયું છે ? અવિદ્યા, અવિદ્યારૂપી કેત્રમાં એ કલેશો ઊગી નીકળે છે. જો અવિદ્યાકેત્ર જ ના હોય તો પછી કલેશો જ ના હોય. તે ઊગે જ કયાં ? 'મૂલો નાસ્તિ કુતાઃ શાખા' જો તેને મૂળ જ ના હોય, ઊગવાની ભૂમિ જ ના હોય તો તે ઊગી જ ના શકે. ઊગવાની ભૂમિ છે અવિદ્યા, અવિદ્યારૂપી ભૂમિ ના હોય તો કલેશોરૂપી જાડ ઊગી જ ના શકે.

ઉપરોક્ત પાંચેય કલેશોની ચાર અવસ્થાઓ છે, ચાર સત્રો છે. કલેશોની ચાર અવસ્થાઓને જો બરાબર ના સમજાયે તો ખબર કઈ રીતે પડે કે તે કઈ અવસ્થામાં રહેલા છે ? તેથી તેની અવસ્થાઓને-સત્રોને-ભૂમિકાઓને સમજાયે.

પહેલી 'પ્રસુપ્ત' અવસ્થા છે. મનુષ્યમાં, સાધકમાં જો કલેશ પ્રસુપ્ત અવસ્થામાં પડેલો હોય તો તેને તેની ખબર પડતી નથી. કલેશની હાજરીની ખબર ફક્ત તે 'ઉદાર' અવસ્થામાં હોય છે ત્યારે જ પડે છે. ઉદાર સિવાયની જ્ઞાન અવસ્થામાં તે કલેશની હાજરીની ખબર જ પડતી નથી. અને જો તેની હાજરીની ખબર જ ના પડે તો મનુષ્ય સાવધાન કેવી રીતે રહી શકે ? એ ગાફેલ જ રહે. પ્રસુપ્ત અવસ્થામાં કલેશ રહેલો હોય ત્યારે તેની હાજરીની આપણાને ખબર જ ના પડે.

અહીં 'સૂપ્ત' નહીં પણ 'પ્રસુપ્ત' શબ્દ વાપર્યો છે. ગાઢ-પ્રગાઢ નિદ્રાને પ્રસુપ્ત કહી શકાય. જેમકે અમુક ભાઈ પ્રગાઢ નિદ્રામાં છે, ગાઢ નિદ્રામાં કોઈ મનુષ્ય મેડી ઉપર સૂતો હોય અને આપણો તેને નીચેથી બૂમ પાડીએ તો એ સાંબળશે નહીં. તેને ઉડાડવો હોય તો શું કરવું પડે ? ઉપર જવું પડે અને પછી એનો હાથ કે પગ પકડી એને હલાવીએ, એના શરીરને જરાક ઢંઢોળીએ અને પછી બૂમ મારીએ તો એ જાગી જાય. પ્રસુપ્ત અવસ્થામાં રહેલા કલેશને સમજાવવા માટે આ એક દિશાંત આપ્યું. આ રીતે પ્રસુપ્ત અવસ્થામાં રહેલા કલેશની હાજરીની આપણાને ખબર પડતી નથી; તે આપણને કલેશિત કરી શકતો નથી, તેથી આપણો અસાવધાન રહી જઈએ છીએ. પરંતુ તે કલેશને યોગ્ય કારણ મળી જાય કે યોગ્ય નિમિત્ત મળી જાય ત્યારે તે જાગી જાય છે અને ત્યારે આપણાને ખબર પડે છે કે આપણામાં કલેશ છે. અત્યાર સુધી તો આપણો એમ સમજતા હતા કે આપણામાં

કલેશ નથી. પરંતુ હવે આ કલેશની હથાતીની-હાજરીની ખબર પડી. ક્યારે ? એ જાગી ગયો ત્યારે. કાઈક કારણ ઉપસ્થિત થાય અને તેને જગાડી દે ત્યારે જાગે. પરંતુ જો પ્રસૂખ અવસ્થામાં પણ ન હોય તો પછી ભલેને ગમે તેટલાં નિમિત્ત ઊભાં થાય પણ તેની જો હાજરી જ નથી તો પછી તે ક્યાંથી જાગે? જો તેને પ્રસૂખ અવસ્થામાં પણ ના રહેવા દીધો હોય તો તે જાગી ના શકે.

તો, આ થઈ પ્રસૂખ અવસ્થા. કલેશ જો પ્રસૂખ અવસ્થામાં પડ્યો હોય તો આપણે અસાવધાન, ગાફેલ રહી જઈએ. તેની હાજરીની આપણને ખબર જ ના પડે.

પછી 'તનુ' અવસ્થા આવી. કલેશ, જો ચિત્તભૂમિમાં તનુ અવસ્થામાં પડેલો હોય તો પણ તેની ખબર ના પડે. આપણે અસાવધાન હોઈએ અને તેને પણ જો મજબૂત બનાવનારું નિમિત્ત ઊભું થાય તો તે પણ જાણી જાય. જો કે તનુ અવસ્થામાં રહેલ કલેશની આપણને ઘોડી ખબર પડે છે. પરંતુ પ્રસૂખ અવસ્થામાં રહેલા કલેશની તો આપણને બિલકુલ ખબર નથી પડતી. જ્યારે તે તનુ અવસ્થામાં હોય ત્યારે તેની હાજરીની ક્યારેક ખબર પડે અને ક્યારેક ન પણ પડે અને કદાચ ખબર પડે તોય આપણા મનમાં એમ હોય કે જ્યારે ધારીશું ત્યારે આપણે તેને મચરીને તોડી નાખીશું. આ રીતે આપણે ગાફેલ રહી જઈએ.

કલેશને તનુ કરી નાખવા અને સમાણિની પ્રાપ્તિ કરવાની તે કિયાયોગનું પ્રયોગન છે. આ સૂત્રમાં શું કહું ? કલેશને તનુ કરી શકાય છે. તે તનુ અવસ્થામાં હોય ત્યારે તેના વિષે આપણે બેખરવાડ હોઈએ, ત્યારે આપણા મનમાં એમ હોય કે આ નિર્બંધ કલેશને જોતજોતામાં ફરી દઈશું, તેને નાચ કરવામાં શી વાર લાગવાની હની! પરંતુ તે મહાબળવાન બની ગયા પછી આપણે તેને નાચ ન કરી શકીએ. વડનું એક બી જાગીનમાં હોય અને તેનો કોઠો (કષાગો) કૂટીને બહાર નીકલ્યો હોય ત્યારે તે કેટલો નાજુક હોય છે ? એક નાનું બાળક પણ રમત રમતમાં તેને તોડી નાખે છે. પરંતુ તેને અનુકૂળ વાતાવરણ અને હવાપાણી મળતાં રહે તો તે જ નાનો કોઠો વડવૃક્ષ બની જાય છે, કબીરવડના રૂપમાં પરિવર્તન પામી જાય છે ! શુક્લતીર્થમાં કબીરવડ છે. તેને પાડવો કે તોડવો હોય તો કોની તાકાત ? મોટા મોટા હાથીઓ તેને બટકાય તો તે હાથીઓ પણ પછડાઈ જાય.

જુલાઈ-૮૩

અને તેમની સુંદરો પણ તૂટી જાય તોય તે કબીરવડને કાઈ જ હીજા ના થાય. જે કષાગો હુકમાત્રથી તૂટી જાય તેવા સ્વરૂપમાં હતો તે અત્યારે તેવા સ્વરૂપમાં આવી ગયો ? તે વજના પછાડ જેવો થઈ ગયો. તેમ આપણામાં રહેલો તે કલેશ કે જે તનુ અવસ્થામાં છે તેને તનુ અવસ્થામાંથી જ નાચ કરવાનો પ્રયત્ન કર્યો હોય તો તે આસાનીથી નાચ થઈ શકે. પરંતુ જ્યારે તેને વિશાળ, વિરાટ બનાવી હે તેનું કોઈ કારણ આવી મળે છે ત્યારે તે ખૂબ મજબૂત બની જાય છે; પછી તો તેને નાચ કરવો એ ઘણા મોટા પુરુષાર્થનું કાર્ય થઈ જાય છે. કલેશ જ્યારે તનુ અવસ્થામાં હોય ત્યારે જ સાપ્તકે સાવધાન થઈ જવું જોઈએ.

તો જી અવસ્થા છે વિચિન્ન અવસ્થા- એક કલેશ, બીજા વિજાતીય કે સજાતીય કલેશથી દબાઈને પડેલો હોય તે તેની વિચિન્ન અવસ્થા કહેવાય.

કોઈ કલેશ પોતાના સજાતીય કે વિજાતીય કલેશથી દબાઈને પડેલો હોય ત્યારે પણ તેની હાજરીની ખબર પડતી નથી. 'રાગ' કલેશથી 'દ્રોગ' કલેશ કે દ્રોગ કલેશથી રાગ કલેશ દબાઈને પડેલો હોય તો તે કહેવાય કલેશની વિચિન્ન વિજાતીય અવસ્થા; અને રાગ કલેશથી રાગ કલેશ કે દ્રોગ કલેશથી દ્રોગ કલેશ દબાઈને પડેલો હોય તો તે કહેવાય કલેશની વિચિન્ન સજાતીય અવસ્થા.

કલેશની ચોથી અવસ્થા તે ઉદાર અવસ્થા. ઉદાર અવસ્થામાં રહેલા કલેશની બરાબર ખબર પડે છે. કારણ કે ઉદાર અવસ્થામાં રહેલો કલેશ આપણને કલેશિત કરી જ રહ્યો હોય છે, ત્રાસ આપી જ રહ્યો હોય છે; આપણે તેનામય થઈ ગયા હોઈએ છીએ. આમ, આપણે કોઈ વિષયને બોગવતા જ હોઈએ ત્યારે કલેશની તે ઉદાર અવસ્થા થઈ કહેવાય.

એક સ્વભાવ દણાંતથી ઉપરોક્ત કલેશોમાંથી રાગ કલેશને તથા તેની ચાર અવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીએ.

પ્રસૂખ અવસ્થા : એક મનુષ્ય કે જેને સિગારેટ પીવાનું પાકું બસન છે. સિગારેટ પીવામાં તે ખૂબ સુખ લઈ રહ્યો છે. પરિસ્થિતિવશ એને એવી જગ્યાએ રહેવા જવાનું થયું કે જ્યાં સિગારેટનાં દર્શન પણ થતાં ના હોય. એને સિગારેટ પીવાની તૃપ્તા ખૂબ સતતવતી હોય પણ ત્યાં સિગારેટ મળી શકે તેમ જ ના હોય. એમને એમ દિવસો, મહિનાઓ અને

વર્ષો પસાર થઈ જાય. જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ સિગારેટ પીવાની એની તુણાની યાદ ધીમે ધીમે, લુલાતી લુલાતી સંપર્ક વિસ્મૃત અવસ્થામાં ચાલી જાય. આ થઈ રાગ કલેશની પ્રસૂપ અવસ્થા.

તનુ અવસ્થા : એ મનુષ્ય સંજોગો બદ્ધલાતાં પાછો પોતાના મૂળ સ્વાને રહેવા આવી જાય છે. પોતાની ઓડિસે નોકરી જવાનું શરૂ કરી હે છે. ઓડિસમાં પોતાની આજુભાજુમાં પોતાના મિત્ર-સ્નેહીઓને સિગારેટનું સુખ માશ્શતા જુબે છે. એ જોઈને પોતાનું સિગારેટ-સુખ (કે પ્રસૂપ અવસ્થામાં ચિંતબૂભિમાં પડેલું જ હતું) તેની યાદ આવી જાય છે. તે થઈ રાગ કલેશની તનુ અવસ્થા.

વિચિન સંજીતીય અવસ્થા : રાગ કલેશ સંજીતીય (રાગ) કલેશ દારા અથવા વિજીતીય (દેખ) કલેશ દારા દબાઈને પડી રહેલો હોય તો તે થઈ વિચિન અવસ્થા. પરંતુ ડૉક્ટરે સુખના આપી હોય કે “હેલે સિગારેટ પીશો તો ટી.બી. કે કન્સર થઈ જશે.” એ વખતે સિગારેટના સુખ કરતાં આરોગ્યનું સુખ ઘણું મોટું લાગવાથી સિગારેટ પીવાનું છોડી દઈએ. આ જગ્યાએ રાગ કલેશથી રાગ કલેશ દબાઈને પડેલો છે. તેથી આ થઈ રાગ કલેશની વિચિન સંજીતીય અવસ્થા.

વિચિન વિજીતીય અવસ્થા : ડૉક્ટર કહે કે “તમને રાત-દિવસ જે ખાંસી આવે છે તે સિગારેટના કારણો આવે છે.” તે વખતે ખાંસીના ફુલ તરફની જે ધૂણા તે ધૂણા (દ્વિકલેશ) દારા સિગારેટના સુખની તુણા (રાગ કલેશ) દબાઈ જવી તે થઈ રાગ કલેશની વિચિન વિજીતીય અવસ્થા.

ઉદાર અવસ્થા : જે મનુષ્યનો સિગારેટ-સુખ-તુણા રૂપી રાગ કલેશ પ્રસૂપ અવસ્થામાં હતો, તેને ઓડિસે જવાનું થતાં પોતાની આસપાસ સિગારેટ પીનારાઓને ઓવારૂપી અનુકૂળતા મળી જાય, તો તેના રાગ કલેશની પ્રસૂપ અવસ્થા દૂટી જાય. રાગ કલેશ પ્રસૂપ અવસ્થામાંથી જગ્યોને ઉદાર અવસ્થામાં આવી જાય. તેના સિગારેટ-સુખની સ્વૃતિરૂપી તનુ અવસ્થામાં રહેલા કલેશને થોડા મિત્ર-સ્નેહીઓના આગ્રહરૂપી અનુકૂળતા પ્રાપ્ત થઈ જાય તો તેનો રાગ કલેશ તનુમાંથી ઉદાર અવસ્થામાં આવી જાય. એને જો “સિગારેટ પીવાથી આરોગ્ય બગડતું નથી, એ તો બધી પ્રમાણાઓ છે” એવી સલાહરૂપી અનુકૂળતા પ્રાપ્ત થઈ જાય તો એનો રાગ કલેશ વિચિન સંજીતીય અવસ્થામાંથી ઉદાર

અવસ્થામાં આવી જાય. તેના વિચિન વિજીતીય અવસ્થામાં રહેલા કલેશને “ખાંસી સિગારેટ પીવાથી નહીં પણ શરીરના કારણો થઈ હતી” એવી ડૉક્ટરી સલાહરૂપી અનુકૂળતા પ્રાપ્ત થઈ જાય તો એનો રાગ કલેશ વિચિન વિજીતીય અવસ્થામાંથી ઉદાર અવસ્થામાં આવી જાય.

પ્રસૂપ અવસ્થામાં રહેલા કલેશ, પોતાને અનુકૂળ વાતાવરણ મળતાં, પ્રસૂપ અવસ્થામાંથી સીધા જ ઉદાર અવસ્થામાં આવશે કે અનુકૂળે - પ્રસૂપમાંથી તનુમાં, ને તનુમાંથી વિચિનમાં, ને વિચિનમાંથી ઉદારમાં આવશે - એ એને મળતા વાતાવરણની તીવ્રતા-મંદટા ઉપર અવલંબિત છે. પ્રસૂપ અવસ્થામાંથી ઉદાર અવસ્થામાં આવતાં સુધીમાં કઈ અવસ્થામાં ટેટલો સમય પસાર થશે એ પણ એને મળતાં કારણો અને વાતાવરણની તીવ્રતા-મંદટા ઉપર આધારિત છે.

ભોગવેલા સુખની સંપર્ક વિસ્મૃતિ, (નીજરૂપે તો તેનું અસ્તિત્વ હોય) તે થઈ રાગ કલેશની પ્રસૂપ અવસ્થા. ભોગવેલા સુખની અલ્ય-અધિક સ્મૃતિ તે થઈ રાગ કલેશની તનુ અવસ્થા. ભોગવેલા સુખને પુનઃ ભોગવામાં, અન્ય સંજીતીય કે વિજીતીય કલેશ રૂકાવત નાંબે, તે થઈ રાગ કલેશની વિચિન અવસ્થા, ભૂતકાળમાં ભોગવેલાં વિષય-સુખો વર્તેમાનકાળમાં સામાં આવે ત્યારે તેને કિયાત્મકરૂપે ભોગવા લાગવું તે થઈ રાગ કલેશની ઉદાર અવસ્થા.

પ્રસૂપ, તનુ, વિચિન અને ઉદાર; આ ચાર અવસ્થામાં રહેલા કલેશનું કેત્ર કર્યું છે ? અવિદ્યા. એટેલે જો અવિદ્યાને ટાળીએ તો આ ચારેય અવસ્થામાં રહેલા કલેશો ટણી જાય, નાચ થઈ જાય. કોઈપણ પ્રકારનું બીજ વાવવું હોય તો તેને માટે યોગ્ય કેત્ર-ખેતર હોવું જોઈએ. કેત્ર એટલે ખેતર, ખેતર વિના બીજને ક્યાં વાવીએ ? ગમે તેટલા ઉત્તમ પ્રકારનું બીજ હોય પણ જો તેને વાવવું હોય તો યોગ્ય જમીનની જરૂર પડે.

તો આમ, અવિદ્યારૂપી કેત્રમાં પાંચમાંના ગમે તે કલેશો ઊગી નીકળે છે. માટે અવિદ્યાને ભગડાડીએ તો કલેશો નાચ થઈ જાય.

આવતા અંકમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દેખ અને અભિનિવેશ કલેશોને સમજવાનો પ્રયત્ન કરીશું. અસ્તુ.

(કમશા :)

(“શાંતા” પુસ્તકમાંથી સાભાર)

પૂજય ગુરુદેવની કહુણા

શાસ્તીકાળ પટેલ

(પ.પુ. ગુરુદેવ શ્રી પોગભિસ્કૃત સાથેનાં સંસ્મરણો)

ઉનાણમાં શાળામાં રજાઓ પડે તે સમયે પુ. ગુરુદેવ સાથે ઘણી વખત બહારગામ જવાનો પ્રસંગ બનતો. આ રીતે એક વખત જંગામાતાની જંજરી (જેને ડાબાની જંજરી પણ કહે છે ત્યાં) જવાનું નક્કી થયું. જંજરી જવા માટે અમદાવાદથી બસમાં બેસી મોટી એહર નામના ગામે ઊત્તર્યા. ત્યાંથી લગભગ પાંચેક કિલોમીટર ચાલીને જંજરી જવાય. આ રસ્તો ઘણો ખરાબ, મોટી એહરથી થોડુંક ચાલીએ એટલે રેતીના ધરના ધર વાળો રસ્તો આવે. ચાલીએ ત્યારે રેતીના ધરમાં પગ ખૂબી જાપ; આમ ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે. અમારી સાથે ગુરુદેવ, નાનાં બાળકો તથા સામાન પણ ધણો; કેમકે જંજરીમાં તો તે સમયે કાઈ જ મળતું ન હતું, તેથી બધું અમદાવાદથી સાથે લઈને જ જવું પડતું. જો નાનીસરાખી કોઈ ચીજની જરૂર પડે તો પાંચ ક્ર.મી. ચાલીને એહર ગામે આવીએ ત્યારે મળે.

મોટી એહર ગામેથી જાણીતા એક બાઈ સાથે વાત કરીને ગાડાની વ્યવસ્થા કરી. ગાડામાં બધો સામાન ગોઠવી, પુ. ગુરુદેવ સાથે અમે પણ ગોઠવાયા. અમારું ગાડું જંજરી જવાના રસ્તો આગળ વધવા માંદ્યું, થોડે આગળ ગયા પછી રેતીના ધરવાનો રસ્તો શરૂ થયો. આવા રસ્તામાં અમારા સૌના વજનને કારણે બજદ બિચારો ચાલી શકે નહીં. તેથી ગાડાવાળો બજદને ચલાવવા માટે લાકીથી મારવા લાગ્યો, લાકીના આગળના ભાગમાં રાખેલ પરોણો (અણીદાર ખીલી જેવો ભાગ) બજદની પીડમાં ધોંચવા લાગ્યો. આ જોઈને કરુણાની જીવંત મુર્તિરૂપ ગુરુદેવ ગાડાવાને કહું કે, “બાઈ, જીબો રહે. બજદને મારીશ નહીં. એક તો આ રેતીના ધરવાનો રસ્તો અને ઉપર અમારા સૌનો બાર! આટલો ભાર ખેચીને બજદ કયાંથી ચાલે? અને બજદ ચાલતો નથી એટલે તું એને મારે છે; તો તે બિચારા મુંગા પ્રાણીની શી લાલત થાપ? ” આટલું કહીને ગુરુદેવ ગાડામાંથી ઊતરી ગયા. ગુરુદેવની પાછળ પાછળ અમે સૌ પણ ઊતરી

ગયા, નીચે ઊતરીને ગુરુદેવે મને કહું કે, તું પાછળથી ગાડાને પકડો માર જેથી બજદને ચાલવામાં મુશ્કેલી પડે નહીં. આમ, મહામુશ્કેલીએ અમે સૌ જંજરી મુકામે પછોંચ્યા.

જંજરીમાં ખૂબ આનંદમાં સમય બસ્તિત થતો હતો. પ્રાતઃકાળે અને સંધ્યાકાળે સ્વાધ્યાય-સત્સંગ ચાલતો. બાજુમાંથી પસાર થતી જંજરી(અરણા)નું પાણી તેની નજીકમાં આવેલ ગોમુખમાં થઈને જાડી ધાર સાથે નીચે પડતું. અહીં નાઢવાની ખૂબ મજા પડતી. સૌ ગુરુભાઈને પોતાપોતાને સૌપાણેલું કાર્ય કરવામાં મશગૂલ રહેતાં. કાજલ સમયે સૌ મંત્રજલ કરતાં કે આરામ કરતાં. આમ ને આમ લગભગ ચારેક દિવસ પસાર થઈ ગયા.

એક દિવસ સાંજના સમયે પર્મશાળાના પગચિયા પાસે ગુરુદેવ એક નાનકડા પક્ષીને અધમૂઈ લાલતમાં પહેલું જોયું. તેની સ્વિતિ બહુ ખરાબ હતી. તે ઊડી શકે તેમ નહોંતું. તેથી ગુરુદેવ તેને ડણકેથી લાલતમાં ઊપાડી લીધું અને પોતાના રૂમમાં લઈ જઈ બારી પાસે મુક્યું. પછી તેની આગળ, એક વાસથામાં પાણી બરીને મુક્યું તથા બીજા વાસથામાં દૂધ બરીને થોડા રોટલીના દુકડા સાથે મુક્યું. પક્ષીએ થોડું પાણી પીધું અને રોટલીના દુકડા ખાયા. થોડા સમય બાદ પગ દ્વારા પસતું-પસતું દીવાલની ઓથે લયાઈ ગયું. ત્યારબાદ ગુરુદેવ ત્યાં ને ત્યાં જ લાંબા સમય સુધી બેસી રસ્તા અને એ વાતનું સતત ધ્યાન રાખ્યું કે બારીમાંથી બિલાડી આવીને પંખીને મારી ના નાખે. ગુરુદેવને કામ અર્થ ત્યાંથી ખસતું પડે ત્યારે તેઓ અમારામાંથી કોઈને એ પક્ષીની સંભાળ રાખવાનું કાર્ય સોંપતા. આમ, સતત બે-ત્રણ દિવસ પક્ષીની શુશ્રાય કરી. હવે તે પક્ષી ગુરુદેવના ઓરડામાં નિર્ભયપણે ઊજા કરતું, તે બરાબર ઊડતું થયું એટલે ગુરુદેવ તેને ખાબા ઉપર લઈ ગયા અને ઊડાડી મુક્યું. આ પ્રસેગળા સ્મરણ સાથે ગુરુદેવ રચિત બજનાની લીટીઓ યાદ આવી જાય છે.

જગ આખાને કુદુંબ સમજે,
જીવ-રક્ષા માટે જો પાય;
તો પછી બીજે શા માટે જાય.

ગુરુદેવ “વસુધૈવ કુટૂંબકમ્રૂ” ની ભાવનાનું જીવંત પ્રતીક છે. વિશ્વના સમસ્ત જીવ-જગતને ગુરુદેવ કુટૂંબ માને છે. જીવમાન માટે ગુરુદેવના ફદ્યમાંથી દયા, કરુણા અને અનુકૂળાનો અતૃપ્ત સ્વોત વહી રહ્યો છે. કોઈ પણ જીવ સહેજ પણ હુંઘી થતો હોય તો તેઓનું ફદ્ય દ્વારા ઉઠે છે. તે જીવને હુંઘમુક્ત કરવા પોતે તકલીક વેઠીને પણ સતત પ્રયત્નશીલ રહે છે. આપણે પણ આપણા જીવનમાં આ ભાવને શક્ય તેટલો ઉત્તરવા પ્રયત્નશીલ રહીએ. અસ્તુ.

અમારી ધર્મશાળા પાસે ને ડાખિયા કૂતરા રહેતા. મંદિરના પૂજારી પાસેથી સાંભળેલું કે તે કૂતરા હિંસક સ્વભાવના હતા અને કોઈપણ અનુભૂતાને કરડવા પસી જતા. મોટી જેહરથી અમે જાંઝરીની ધર્મશાળાએ પહોંચ્યા ત્યારે અમે ગાડામાંથી સામાન ઉતારી રહ્યા હતા તે દરમાન ગુરુદેવ ચાલતા-ચાલતા ધર્મશાળા પાસે પહોંચ્યી ગયા. અમારા આશ્રય વચ્ચે અમે સૌંભે જોયું કે પેલા ને કૂતરા પોતાનો હિંસક સ્વભાવ હોડી જાણે પાંચલા કૂતરા હોય તેમ ગુરુદેવના પગ પાસે આળોટવા લાગ્યા.

આપણે સૌ જાણીએ છીએ કે ગુરુદેવની સાધના મુખ્યપણે પાતંજલ યોગદર્શનક્વિત અણંગપોગ ઉપર આધારિત છે.

યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ગ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ - યોગનાં આ આઠ અંગ છે. પ્રથમ અંગ ધમના પાંચ ઉપાંગો છે - અહિસા, સત્ય, અસ્તોય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અહિસા માટે પતંજલિ મુનિ કહે છે કે - “અહિસા પ્રતિજ્ઞાયાં તત્ત્વસિદ્ધી વૈરત્યાગः”

જે વાક્તિમાં મન-વચન-કર્મ અને વિચાર-વાચી-વર્તનથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અહિસા દઢ થઈ ગઈ હોય તેમની પાસે હિંસક સ્વભાવવાળો જીવ પોતાનો સ્વભાવ ભૂલી જાય છે અને અહિસા બની જાય છે. આપણે સાંભળેલું છે અને વાંચેલું પણ છે કે ઋથિમુનિઓના આશ્રમમાં સિંહ જેવાં હિંસક પણ અને હરણાં સાથે જેસતાં. સત્તુગનની આ વાતો કલિયુગમાં પણ તાદૃશ્ય થતી જોઈ. હિંસક કૂતરાએ પોતાનો હિંસક સ્વભાવ ભૂલીને અમારા જીની સાથે તથા નાનાં બાળકો સાથે રમવા લાગ્યા અને અમને તો ઠીક પણ પેલા વધાયેલા પક્ષીને પણ નુકસાન ન પહોંચાડ્યું.

આવી છે અહિસાની તમાલ!

આવો છે અહિસાનો ચમત્કાર!

આવી છે ગુરુદેવની કરુણા!

સત્તસંગ-સમજજ્ઞ યદી

-૧૫૪૪ દાખ

(સ્થળ : ગીતાસદન હોલ, મુ. વલસાડ)

ગુરુપ્રેમી શ્રી ડિરક્ષાભાઈ, શ્રી પ્રયમેશભાઈ અને શ્રી ડિશોરભાઈની ઘણા સમયની ઈચ્છા કે પ.પ્ર. ગુરુદેવ શ્રી યોગભિકૃત વલસાડ મુકામે પણારે અને ત્યાંની જનતાને આધ્યાત્મિક વાણીનો લાભ આપે. તેમની ઈચ્છાપૂર્તિ થાય અને લોકોને આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય; આ બંને વાતને ધ્યાનમાં રાખીને પૂજ્યપદ્માને વલસાડમાં જાહેર પ્રવયન આપવાનું સ્વીકાર્ય. તા. ૩-૪-૯૮ અને ૪-૪-૯૮ના રોજ આ કાર્યક્રમની જાહેરાતના લગભગ વીસેક હજાર પેન્કલેટ વહેચલામાં આવ્યાં. પૂજ્યપદ્માને આ કાર્યક્રમનું નામ આપ્યું ‘સત્તસંગ-સમજજ્ઞ યદી’.

ઉપરોક્ત કાર્યક્રમમાં ભાગ લેવા, પૂજ્યપદ્માની તા. ૨-૪-૯૮ના રોજ અમદાવાદથી નીકળ્યા. સાથે ને-ત્રણ ગુરુપ્રેમી ભાઈ-બહેન પણ હતાં. અમદાવાદથી વલસાડ જતાં રેસ્ટામાં નહિયાદ, આંશંદ, નવસારી વગેરે સ્વષ્ટોને ગુરુભાઈબહેનોએ પૂજ્યપદ્માનું ભાવ સ્વાગત કર્યું. વલસાડ પહોંચ્યા ત્યારે વલસાડ ઓમ્પ્રદિવાર સ્ટેશન ઉપર હજાર હતો. તેમણે સૌંભે કૂલલારથી પૂજ્યપદ્માનું સ્વાગત કર્યું. ખેટકોર્મ બહાર નીકળી પૂજ્યપદ્મ કારમાં બેઠા. કારને કૂલલારથી ખૂબ

ઉપરોક્ત કાર્યક્રમમાં ભાગ લેવા, પૂજ્યપદ્માની તા. ૨-૪-૯૮ના રોજ અમદાવાદથી નીકળ્યા. સાથે ને-ત્રણ ગુરુપ્રેમી ભાઈ-બહેન પણ હતાં. અમદાવાદથી વલસાડ જતાં રેસ્ટામાં નહિયાદ, આંશંદ, નવસારી વગેરે સ્વષ્ટોને ગુરુભાઈબહેનોએ પૂજ્યપદ્માનું ભાવ સ્વાગત કર્યું. વલસાડ પહોંચ્યા ત્યારે વલસાડ ઓમ્પ્રદિવાર સ્ટેશન ઉપર હજાર હતો. તેમણે સૌંભે કૂલલારથી પૂજ્યપદ્માનું સ્વાગત કર્યું. ખેટકોર્મ બહાર નીકળી પૂજ્યપદ્મ કારમાં બેઠા. કારને કૂલલારથી ખૂબ

શાશ્વતારેલી. કારની બંને બાજુએ ઓમ્નારાપણની પછાંથે ફરકતી હતી. કાર શ્રી દિરણભાઈના ઘર પસે આવીને ઊભી રહી. પૂજ્યશ્રી કારમાંથી ઊતરો દિરણભાઈના નિવાસસ્થાનમાં પખાર્યો. 'સત્ય-પર્મ ગુરુદેવની જ્ય' ના નાથથી આખું ઘર ગુજ ઊઠ્યું.

તે જ દિવસે સાંજે અમે સૌ પૂજ્યશ્રી સાથે તીથલના દરિયાદિનારે ફરવા ગયા. દરિયાનાં મોખાંનો ગુંજારવ, પાણી ઉપરથી આવતો શીતળ પવન, આજુબાજુની વાડીઓની લીલોતરી વળેરે વાતાવરણને આદુલાદક બનાવતાં હતાં. થોડે દૂર જઈ અમે સૌ દરિયાની રેતીમાં બેઠાં.

થોડા સમય સુધી સૌ શાંત બેસી રહ્યાં. પછી એક ભાઈને પૂજ્યશ્રીને પ્રશ્ન કર્યો કે આત્મા અને પરમાત્મા એ બગે જુદા છે કે એક જ છે? પૂજ્યશ્રીએ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું કે -

"દ્વૈત, અદ્વૈત, દ્વૈતદ્વૈત, તૈત એમ અનેક વાદ છે. પરંતુ પરમતત્ત્વ વિષે જુદા જુદા છે મત પ્રવર્ત છે તે સાચા છે કે ખોટા છે, કે કયો મત સાચો છે અને કયો મત ખોટો છે એ વાદવિવાદમાં પડવાની જરૂર નથી. આપણે તો પરમતત્ત્વ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. સાચો સાધક એ છે કે જે નાહકના વાદવિવાદમાં પડ્યા વિના પોતાના ગુરુદેવ બતાવેલ સાપનામાં રત રહે છે અને પોતાના લક્ષ્ય તરફ આગળ વખતો રહે છે. અને એક વાપત પરમતત્ત્વને જીણી-સમજી-અનુભવી લીધું પછી તે બધા વાદવિવાદથી પર જઈ જાય છે.

"સાધક જો પોતાના લક્ષ્ય તરફ આગળ જો વધે અને વાદવિવાદમાં કસાઈ જાય તો તેની હાલત પેલા મારવાડી ભાઈઓ જેવી થાય છે જેમણે હાથીને પ્રથમ વખત જોઈને કહ્યું કે, 'અઠ પુણ્ય, બઠે પુણ્ય, મુઢો કઠે.'"

પૂજ્યશ્રીનો ઉત્તર સાંલળી પ્રશ્નકર્તા ભાઈના મનનું સમાધાન થઈ ગયું. ત્યારબાદ બીજા એક ભાઈએ પ્રશ્ન કર્યો કે ધ્યાન માટે દરિયાદિનારાનું વાતાવરણ કેવું ગણાય? ધ્યાન કર્યાં કર્તૃં જોઈએ? પૂજ્યશ્રીએ હસતાં હસતાં જવાબ આપ્યો કે -

"ધ્યાન વિષે આપણાં પુસ્તકોમાં ઘણીબધી વાતો રજૂ થઈ છે. શક્ય હોય તો 'ધ્યાન શા માટે?' પુસ્તિકા જોઈ જવી. છતાંય એટલું જરૂર કહીશું કે ધ્યાન લાગતું એ બહુ જુલાઈ-૮૩

સહેલી વાત નથી. સૌ પ્રથમ તો નિર્વિચાર રહેવાનો વિચાર કર્યા કરો, આ વિચારને દંડ કરતા જાઓ. લાંબા સમયના અભ્યાસ પછી કેટલીક વણો, કેટલીક મિનિટો એવી આવરે કે જ્યારે તમે સાચા અર્થમાં નિર્વિચાર થઈ શકશો. આમ નિર્વિચાર રહેવામાં સફળ થયા તો ધ્યાનમાં તમે સહેલાઈથી સફળ થઈ શકશો."

આ રીતે રાત્રે લગભગ નવ વાગ્યા સુધી સત્સંગ ચાલતો રહ્યો. ત્યારબાદ સૌ પોતપોતાના નિવાસસ્થાને ગયાં.

બોજે દિવસે એટલે તા. ૩-૪-૮૭ના રોજ નિયત સમય પહેલાં ઓમ્પરિવારના સ્વયંસેવકો ગીતાસદન હોલ ઉપર પહોંચે ગયા. હોલને તથા સ્ટેજને શાશ્વતારવાની જ્વાબદારી તે સૌના શિરે હતી. તેમણે તેમની જ્વાબદારી ભરાબર સંભાળી. હોલને ખૂબ સારી રીતે શાશ્વતાર્યો. ધજ-પતાકા અને સુવાક્યોના બેનરો ચારે બાજુ લગાવ્યા. આમ હોલમાં દિવ્ય વાતાવરણ ખરું થયું. શ્રોતાઓ પણ આવવા લાગ્યા. એટલે સ્વયંસેવકોએ "ઓમ્ગુરુદેવ પરમાત્મા, વીનવીએ બનાવો સૌને દિવ્યાત્મા" ની ધૂન બોલાવવાની શરૂઆત કરી. શ્રોતાવર્ગ બક્ઝિતભાવપૂર્વક તેને જીલતા હતા અને અનાપાસે જ બક્ઝિકા પ્રાણાયામનો લાભ મેળવતા હતા.

ઓમ્પરિવારના અખંડ જ્યયણના અને સ્વાધ્યાયના કાર્યક્રમમાં પૂજ્યશ્રી અવારનવાર એ વાત સમજાવે છે કે "લયબદ્ધ રીતે જો કોઈપણ મંત્રનું ગાન કરવામાં આવે અને પ્રામાણિકપણે સૌ બોલતા હોય તો તે ધ્વનિનાં મોખાંઓની અસર ધરે હૂર સુધી થાય છે અને ચારે બાજુનું વાતાવરણ અલોકિક થઈ જાય છે. સાથે સાથે પ્રામાણિકપણે મંત્રગાન કરનારને બક્ઝિકા પ્રાણાયામનો લાભ થાય છે. બક્ઝિકા પ્રાણાયામનો અભ્યાસ જો નિયમિતપણે કરવામાં આવે તો સાપકના શરીર ઉપર ચરણીના થર જામતા નથી. આમ, શરીર ઉપરની ચરણીને હરનાર આ બક્ઝિકા પ્રાણાયામ છે."

તો આમ, ગીતાસદન હોલમાં ઉપસ્થિત શ્રોતાગણ અણ્ણાગોળનું ચોંધું અંગ-પ્રાણાયામનો લાભ લઈ રહ્યા હતા અને વાતાવરણને દિવ્ય બનાવી રહ્યા હતા. થોડા સમય બાદ પૂજ્યશ્રી ગીતાસદન હોલમાં પખાર્યો. પૂજ્યશ્રીનું સ્વાગત પ્રથમ શંખનાં દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ જુદા જુદા ગામ-શહેરના ઓમ્પરિવારના પ્રતિનિધિઓએ કૂલહારથી

પૂજયશ્રીનું સ્વાગત કર્યું, કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રથમેશભાઈ અને શ્રી ડિરશભાઈ કરી રહ્યા હતા. પૂરુષેવ વલસાઓના પ્રથમ વખત જ જાહેર પ્રવચન કરવાના હોવાથી શ્રી પ્રથમેશભાઈએ ડૉ. સદ્ગુરુસમર્પણબિસુલ્લાને પૂરુષેવનો પરિચય આપવા વિનંતી કરી. ડૉ. બિસુલ્લાએ પૂજયશ્રીનો પરિચય આપતાં કહ્યું કે -

“ જેનું સર્વસ્વ પૂરુષેવ જ હોય, જેણે તન-મન-ધન વગેરે સર્વ કાંઈ પૂરુષેવને સમર્પિત કરી દીધું હોય તે, પૂજયશ્રીના પરિચય આપે તે અયોધ્ય જ છે, પરંતુ મારે તો પૂજયશ્રીની લાક્ષણિકતા વિષે જણાવવું છે. પૂજયશ્રીની વાણીમાં તત્ત્વના ભારેખમ શબ્દો નથી હોતા પણ આમ સમાજને તેમના રોણિંદા જીવનમાં ઉપયોગી ધાર્ય તેવા સરળ અને સચોટ શબ્દો હોય છે. પૂજયશ્રીને લેખક કહો કે સંત કહો, માતા કહો કે પિતા કહો; જ્યારે મળીએ ત્યારે બધા જ બાબો તેમનાં વાણી-વર્તનમાં જોવા મળે છે.” ડૉક્ટર બિસુલ્લાએ પૂજયશ્રીનો ટૂંકો અને બાવવાહી પરિચય આપો. ત્યારબાદ પૂજયશ્રીએ સત્સંગ-પ્રવચનની શરૂઆત કરતાં કહ્યું -

“સર્વને અમારા વંદન, અભિનંદન, આશિષ્પ. વંદન એટલા માટે કે આપ સર્વ આત્મસ્વરૂપ છો, અભિનંદન એટલા માટે કે તમે બધા મનુષ્યજનનાની સાર્વકતા માટે પ્રપલશીલ છો અને આશિષ્પ એટલા માટે કે તે આપવાથી આશિષ્પ મળે છે. આપે પુષ્પમાળાથી એક સંતનું-અમારું સ્વાગત કર્યું, આ શાલોની પરિપાઠી છે. પરંતુ અમે તો સાત્ત્વિક ગુરુપૂરુણ સાચી સમજણને કહીએ છીએ.

જે જે સાચી સમજ પમાય,
તે તે ગુરુપૂરુણ ગણાય;
જે જે હુર્ગુણ છુટી જાય,
તે તે પ્રભુભજન ગણાય.

“બધા ઈશ્વર પાસે કંઈ ને કંઈ માંગતા જ હોય છે. ડિશોરનાઈ જેવા પણ બહુ મોટા બિખારી છે. તેઓ પ્રત્યે પાસે મુક્તિની ભીખ મારે છે. કરીકરીને ગર્ભવાસમાં આવવું ના પડે તેની ભીખ મારે છે. મનુષ્યજનને પશુપક્ષીના જન્મ કરતાં શ્રેષ્ઠ રા માટે કશો છે? કરસ્કારે મનુષ્ય જ આત્મતિક શુખ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરી શકે છે. અસ્તુ,

“ચૈત્ર મહિનામાં નવરાત્રીમાં આપણે ગરબા ગાઈએ છીએ. અમે પણ આવા- સાચી સમજણના- ગરબા રેલા

છે જેને બજન-ગરબા કહીએ છીએ. તેની પ્રથમ બે લીટી છે- ‘અંબા આવો રમવા જી, રમવાની અમને હોંશ ધણી.’

“પણ મૂર્ખ માનવી! અંબાજી તો સતત, અંધા રમી રહ્યા છે. એમને જો રમતાં જોવાં હોય, અનુભવવાં હોય તો આપણે રમવાનું બધ કરી દેવું જોઈએ. માયા-મમતામાં રમી રહ્યાં છીએ તે બધ કરીને આધ્યાત્મિકતામાં સ્વિચ થઈ જું જોઈએ. પણી લાલતું હોય, તેમાં વરમા આવતાં હોય તો એમાં આપણાને આપણાં પ્રતિનિબંધ દેખાય ખરું? ના દેખાય. તેવી જ રીતે મોહ-માયા-મમતારૂપી વરમણોમાં આપણે આપણાં આત્મસ્વરૂપ નીરખી રચતાં નથી.

“મંદિર બનાવું શ્રીકોતર તમારું પામધૂમથી હું આરતી ઉતારું; નિવાસ છે કોતરમાં અમારો દીકરા, શીદને કોડે છે મંદિરમાં ઢીકરાં.’ શ્રીકોતર એટલે કોતરમાં વસવાવાળી. ક્યા કોતર? હદ્યપરૂપી કોતર. માતાજી જ્યાં છે ત્યાં આપણે જોતાં નથી, જે રીતે તેમને પામવાનો પ્રયત્ન કરતાં નથી. વિત્તવૃત્તિઓનો નિરોધ કરી શકતાં નથી અને પથરને પૂછે છીએ.

“સ્વાધ્યાય કરતાં હોઈએ કે ધૂન બોલતાં હોઈએ ત્યારે આપણા શરીરમાં ઉષાતા પેદા ધાર્ય છે જે શરીરના રોમેરોમ સુધી ફેલાઈ જાય છે. જો એ પવિત્ર, સાત્ત્વિક ઉષાતા બહાર નીકળી જાય તો પછી શું મેળવ્યું? દા.ત. તપેલીમાં દૂધ ગરમ કરીએ તો તેને એવી રીતે ગરમ કરવું જોઈએ કે તે ઊભરાઈ ના જાય, બેબરો આવે તો અનિન ખસેરી લેવો જોઈએ અથવા અંગ્રે ઉપરથી તપેલી લઈ લેવી જોઈએ. આમ, જ્યારે શરીરની અંદર સાત્ત્વિક ભાવનો ઉદ્રેક ધાર્ય ત્યારે ખાસ સાવધાન રહેવું જોઈએ અને જ્યારે આવા ગરબા કે બજનો ગવાતાં હોય ત્યારે ખાસ સાવધાન રહેવું જોઈએ, સચેત રહેવું જોઈએ. જીવ, શિવ સાથે રમી શકવાને છે? માટે શિવને રમતાં અનુભવવા હોય તો જીવ-આપણે સ્વિચ થાવું પડે. અસ્તુ,

“માયા-પ્રપંચનો થક ઉતારવા માટે આપણે સત્સંગમાં આવીએ છીએ, ગુરુ-સંતો પાસે જઈએ છીએ. આપણે સુખને બહાર ગોતીએ છીએ, જ્યાં છે ત્યાં ગોતતાં નથી. તેનું એક સુંદર દાખાંત છે.

“કલકતા પાસે એક મોટો આશ્રમ, ત્યાં એક સ્વામીજી પાસે આવ્યા,

स्वामीजीनी चरक्षण लઈ बक्त इहेवा लाग्या 'बापछ', हु तो मारी धरवाणीधी थाई गयो हुं; मारे आश्रममां ज रहेहुं छे, मारे मारा घेर नदी जूँ. स्वामीज कहे 'भवे भाई, आश्रममां कावे तो आश्रममां रहे, थोडा दिवस पछी स्वामीज बक्तने साथे राखीने आश्रममां करवा नीक्या. आश्रमनो ध्यानपट, सत्संगलोल वर्गेरे भताववा भतावता स्वामीज बक्तने आश्रमना रसोडामां लઈ गया. बक्ते जोयुं के रसोडामां मोटा मोटा सो चूला छे अने दरेक चूला पासे बहेनो रसोईनुं काम करे छे. रसोइं जोईने स्वामीज, बक्त साथे आगण चाल्या. आपो आश्रम भतावी स्वामीज पोतानी कुटिरमां गया. बीचे दिवसे बक्त स्वामीज पासे आवाने बेडा त्यारे स्वामीजाओ प्रश्न कर्यो के, बाई, आश्रम केवो लाग्यो? रसोडामां शुं जोयुं? बक्त कहे, बापछ आश्रम धांडो सुंदर छे. आश्रमनुं रसोइं खूब मोहुं छे. त्या सो बहेनो केवी शांतिथी रसोईकाम करे छे! स्वामीज कहे, भस! बीजुं काई ना जोयुं? अरे! रसोइं जोईने ऐटलुं तो विचार के तुं तारा रसोडाना एक चूलाथी भाग्याने अहीं आपतो रहो छे, तो अहीं तो सो चूला छे. तने अहीं शांति केवी रीते भएगो? बक्त विचारवा लाग्यो के स्वामीजनी वात तो साची छे. तेनो मूऱ्यायेलो चहेरो जोई स्वामीज आगण कहेवा लाग्या- 'तने एम वर्तुं हशे के हुं एक चूलाथी भाग्यो ज्यारे स्वामीज तो सो चूला संभावे छे; तो स्वामीजनुं अहीं शुं वर्तुं हशे! ? अरे! हुं सो चूला संभावुं हुं तोय भने कहि तकलीफ नदी. आवुं तेम छे ते तुं आजो छे? कारणाके तारा घेर जे एक चूलो छे तेने तुं तारो गणे छे ज्यारे आ सोअे सो चूलाने हुं मारा नदी गणतो. ते रहे तोय शुं अने ना रहे तोय शुं? ईश्वरेच्छा बलीयसी;

आटलुं संबंधतां ज बक्तनी बुद्धिनां दार खूली गयां. बीचे दिवसे सवारे स्वामीजनी आज्ञा लઈ बक्त साची समज्ज्ञ मेजावी साचुं ज्ञान प्राप्त करी पोताना घेरे चाल्यो गयो. आम, आपणो पक्षा दरेक वातमांथी साची समज्ज्ञ मेजाववानो प्रयत्न करवानो छे. अस्तु.

"हुनियानी जोई ताकात 'लघु'ने गुरु बनतां रोडी नदी शके. लघु, गुरु बनीने ज रहेशे."

"जे बुद्धि समर्पित थहिने रहे छे ते ज बुद्धिनी बुद्धिमानी छे. गुरुज्ञो अने संतज्जनोना चरणोमां बुद्धिपूर्वक निर्भुदि थहिने लेसवुं ए ज बुद्धिमानपणुं छे!"

बीज दिवसे सत्संगनी शहुआत प्रश्नवंदनाथी थई. प्रश्नवंदना बाद पूऱ्यश्रीजे 'ईश्वरनुं नाम ओम् छे, प्रश्न छे' ए वातने पातंजल योगदर्शनना समाप्तिपादना सूत्र २४ थी रह ना आधारे खूब विगतवार समजावी. जेनुं विशद वर्णन 'मुक्ता' अने 'ईश्वर तोने कही शकाय?' नामां पुस्तकोमां करेहुं छे. जिज्ञासुओने ईश्वरनी व्याख्या विषे जाश्वानी ईच्छा होय तो तेमधे आ पुस्तको ध्यानपूर्वक वांची ज्ञावां. त्यारबाट पूऱ्यश्रीजे ज्ञावाव्युं के-

"आपवी मोटामां मोटी ईच्छा प्रश्न-परमात्माने प्राप्त करवानी छे परंतु परमात्मा एं काई स्थूल वस्तु थोडी छे? एं तो बुद्धिथी पक्ष आगण चालीजे तो प्रश्नानो - विषय छे. सामान्य सतरवाणाने समज्ज्ञ पडे अने ते प्रश्न-प्राप्तिमां सहज वाय ते माटे अमे तजपटी भाषामां, सरल वाक्षीमां, उपरोक्त पुस्तकोमां धणुं बहुं कही नाह्युं छे. आपको आपकां मोह-ममता छोडी दृष्टी तो ज परमात्म-प्राप्तिमां आगण वधी शकाय.

"मायाना वाणिमां धती जू आपणा परसेवामांथी उत्पन्न वाय छे अने आपकां भाग्यो पक्ष आपणा परसेवामांथी उत्पन्न वाय छे. भाग्यकोमा ममता छे तेथी तेने मारी नामता नदी, ज्यारे मायामानीं जूने शोधी शोधीने मारी नाखीजे छीजे. कारणाके तेनामां आपको भमता नदी. मोह-ममता भक्तम्भवा साधकने पक्ष पछाडी मारे छे. तो, भमत्य छोडीजे तो ज परमात्मप्राप्तिमां आगण वधी शकाय. अस्तु."

"परमात्माजे तो संसार गुजारोपवाणो बनाव्यो छे. आपको हंसनी माफक गुण देवा अने दोष छोडी देवा!"

प्रवचन बाद-पूऱ्यश्रीजे स्वरचित बे-ग्राम भजनो गायां, छेल्ले "चिंतन करेगा जो जैसा, आचरण करेगा वह वैसा; आचरण करेगा जो जैसा, सुखहुत्य भोगेगा वह वैसा" ए मंत्रनी पून सौ श्रोताज्ञनो बोल्या. अने आ रीते वलसाड मुकामे गीतासदन होलमां "सत्संग-समज्ज्ञ पक्ष"नी पूर्णाहुति थई.

શ્રાવજા માસમાં ત્રીજું નેત્ર ખોલીએ

-ધોગામિકુ

બલે આવ્યો રૂડો શ્રાવજા માસ. શ્રાવજા માસમાં રૂડાં આચરણો કરીએ, રૂડું સાંભળીએ, રૂડું નીરખીએ, રૂડું જમીએ, સ્પર્શાએ અને સુંધીએ.

શ્રાવજા માસ એટલે શ્રવજા કરવાનો માસ. ડેવું નીરખવાનું, જમવાનું, સ્પર્શવાનું અને સુંધવાનું રૂડું-ઉત્તમ ગણાય તેને શ્રવજા(કાન) દ્વારા શ્રવજા કરીને(સાંભળીને) ફદ્યમાં ઉતારવાનો માસ તે શ્રાવજા માસ.

શ્રાવજા માસમાં રૂડું જમીએ એટલે કે એવું અને એટલું જમીએ કે જે સરળતાથી પચી જાય. શ્રાવજા માસમાં વર્ષાગ્રહનું હોય તેથી વાતાવરણ ઠંકું અને બેજવાનું હોય. સૂર્યનારાયજાનાં દર્શન પણ ખૂબ ઓછાં થાય. આવાં કારણોસર પાચનશક્તિ મંદ પડી જાય. તેથી જો અન્ય ઝતુઓની જેમ જ વર્ષાગ્રહનું જમતાં રહીએ તો બરોબર પચે નહિ અને તેથી અનેક રોગના બોગ બનીએ. આ રીતે રોગનાં બોગ ન બનીએ તે માટે શ્રાવજામાં એકટાણું કરવાનો રિવાજ છે. પરંતુ એકટાણાના રહસ્યને જાણીએ નહિ અને એકટાણામાં જ ત્રણ ટાણાનું જમી લઈએ તો નુકસાન જ થાય. રોજ ત્રણ વખત જમતાં હોઈએ અને શ્રાવજામાસમાં સાચી રીતે એક વખત જ જમીએ તો બે વખતનું અન્ન પચે. આ અન્નને જરૂરતવાળાને આપીને શ્રાવજામાસમાં પુષ્પ પણ પ્રાપ્ત કરી શકીએ. જેની રિષ્યતિ સારી ન હોય તે આ રીતે જરૂર દાન-પુષ્પ કરી શકે.

શ્રાવજા માસમાં રૂડું નીરખીએ એટલે કે આંખો દ્વારા વિકારો અંતરમાં ન ઊતર્દી જાય તે માટે સાવધાન રહીએ. મનુષ્યના અંતરમાં વિકારો પાંચ હિન્દ્રિયો દ્વારા ઘૂસી જતા હોય છે. પણ આંખ વિકારોને પેસવાનું મુખ્ય દ્વાર છે. પતંગિયું દીપકના પ્રકાશ પર લુખ્ય થઈને પ્રાણ ગુમાવે છે.

શ્રાવજા માસમાં શિવભક્તો મહાદેવ પર બીલીપત્રો ચઢાવે છે. ત્રણ પાનનું ગુમખું હોય તે જ બીલીપત્રો મહાદેવને ચઢાવાય છે તે પણ એક જાણવા જેવું રહસ્ય છે:

બીલીનાં ત્રણ પત્રો ત્રીજી આંખનું સૂચન કરે છે. મહાદેવને ચીંગવા માટે, શિવને પામવા માટે, ત્રિનેત્રપુક્ત બનવું પડશે અર્થાત ત્રીજું બુદ્ધિનું નેત્ર ખોલવું પડશે. માત્ર બે ચર્મચસુઓથી જગતને જેવું નીરખીએ છીએ તેવું જ તે નથી, તેથી કાંઈક વિરોધ, અટપણું, અલૌકિક અને રહસ્યથી ભર્યું-ભર્યું છે. તેનો સ્વાનુભવ કરવા માટે ત્રીજું બુદ્ધિનું-પ્રગતાનું નેત્ર ઉદ્ઘાટિત કરવું પડશે. એટલા માટે ત્રિનેત્ર શિવની ઉપાસના કરવાની છે. શિવલિંગ ઉપર બીલીપત્ર ચઢાવતી વખતે "ત્રીજું નેત્ર ખોલવાનું છે" તેની સતત સ્મૃતિ રહેવી જોઈએ. જો બીલીપત્રો પંત્રવત્ત જ ચઢાવીએ તો સ્વાલાખ તો શું સવાકરોડ ચઢાવી દઈએ તોય કાંઈ લાભ ન મળે.

બીલીમાં અનેક ઔપધીય ગુણો પણ છે. બીલીપત્રનો રસ આંખ માટે શાપદાકારક કષ્યો છે. બીલીનો ગર્ભ અતિસારને રોકવાવાળો મનાય છે. શિવલિંગ પર બીલી ચઢાવવાનાં આવાં અનેક રહસ્યો પામવા અને પચાવવા માટે ત્રીજું નેત્ર ખોલવું જરૂરી છે. જો વહેમો, બ્રહ્મો અને અંધશ્રદ્ધમાંથી મુક્ત થઈને સાચા મનુષ્ય થઈને જાવી શકીએ તો જ શિવ પાસેથી કલ્યાણ માપ કર્યું કહેવાય, તો જ ત્રિનેત્રી પાસેથી આશિષ મેળવ્યા કહેવાય.

શ્રાવજા માસમાં રૂડું સ્પર્શાએ અને રૂડું સુંધીએ. અર્થાત ગંધ અને સ્પર્શ વિષયને તાત્ત્વિક રીતે સમજાયો. ગંધના લોલે બ્રહ્મર અને સ્પર્શના મોહેદાથી જેવું મહાબળવાન પ્રાણી પણ બંધનમાં સપદાય છે તે ન બૂલ્યાએ. બ્રહ્મ, હાથી, મૃગ, પતંગિયું ય એક એક વિષયમાં લુખ્ય રહેનાર કેટલો બધો હુંખી થશે.

જો ત્રીજું નેત્ર ખૂલે તો જ આવાં રહસ્યો સમજાય અથવા જો આવાં રહસ્યો સમજાય તો જ ત્રીજું નેત્ર ખૂલ્યું કહેવાય.

હે સદાશિવ, હે મહાદેવ, હે નીલકંઠ, હે ત્રિનેત્રી ! અમારા સૌનું ત્રીજું નેત્ર ખૂલે તેવી કૃપા કરજો.

શ્રાવણ માસના એકટાણામાં આરોગ્યરક્ષાનું વૈજ્ઞાનિક રહસ્ય છુપાયું છે.

આમ તો રહસ્યને જાણીએ તો બારે માસનું બિન બિન અતિ ઉપયોગી રહસ્ય છે જ - કોઈ માસનું આધ્યાત્મિક, તો કોઈ માસનું આધિક્ષિક, તો કોઈ માસનું આધિક્ષોભીક, દરેક માસનું હવામાન બિન બિન હોય છે, તેથી દરેકનું મહત્વ પણ બિન બિન છે. શોધનારને જરૂર મળે છે, 'જિન ખોજ તિન પાઈયા, ગહરે પાની પૈઠ.' અહીં શ્રાવણ માસ અને તેમાં કરતાં એકટાણાં (એક વરત બોજન) વિષે ઘોડું જાણીએ.

શ્રાવણ માસ ચોમાસાની ઋતુમાં આવે છે. ચોમાસામાં ખૂબ વરસાદ પડે છે. આકાશ વાદળોથી છવાયેલું હોય છે. સૂર્યનારાયણ લબડ-અભક દેખાય છે. ક્યારેક તો આડ આડ દિવસની હેલી થાપ છે. તે વરતે સૂર્યનારાયણ બિલકુલ અદેશ્ય રહે છે. વરસાદના કારણે એક તો ઠંડું વાતાવરણ અને સૂર્યકિરણનો અભાવ - આ બંનેની અસર પાચનશક્તિ ઉપર થાપ છે. પાચનશક્તિ ખૂબ મંદ થઈ જાય છે, ખાવાનું પચતું નથી. તેમાંથી ગંધા ગણાય નહીં એટલા રોગો ફાટી નીકળે છે. અનુભવીઓ કહે છે કે સર્વ રોગોની જનની મંદ પાચનશક્તિ છે.

વિશ્વનાં સમઝન પ્રાણધારીઓને મુખ્ય પ્રાણ પૂરો પાડનાર સૂર્યનારાયણ ગણાય છે. આડ અને વનસ્પતિનાં પાંદડાંઓ ઉપર સૂર્યમાંથી વરસતા પ્રાણપોપકાની અસર સૌ કોઈથી જોઈ શકાય એવી હોય છે. પાંદડાંઓનો ઉપરનો ભાગ કે જે સૂર્ય બાજુ રહે છે તે ચમકતો, વેરો, લીલો અને મજબૂત હોય છે; અને પાંદડાંઓ નીચેનો ભાગ, કે જ્યાં સૂર્યકિરણનો સીખાં નથી પહોંચતાં તે, ચમક વિનાનો, ડિકડો, લીલો અને કોમળ હોય છે. આ એક દાઢાંતથી વિશ્વનાં તમામ પ્રાણધારીઓ ઉપર થતી સૂર્યપ્રાણાના પોપકાની અસરની ડલ્યના કરી શકાય છે.

ગાયત્રીની ઉપાસનામાં પણ મુખ્ય સંવિતા અર્થાતું સૂર્યનારાયણ છે. ઉપ અને આસન એટલે સમજપૂર્વક પાસે બેસવું - આસન લગાવીને પાસે બેસવું વગેરે. ગાયત્રી ઉપાસનામાં સંવિતા પાસે સમજપૂર્વક આસન લગાવીને બેસવાનું

છે. આકાશમાં જે સંવિતા દેખાય છે તે તો અતિ ઉષ્ણ અને અતિ દૂર છે. તેની પાસે કઈ રીતે આસન લગાવવું ? આવી રીતે તેમની પાસે નથી બેસવાનું પરતુ તેમનામાંથી વરસતો ગ્રાણ વધુમાં વધુ લઈ શકાય તેનું રહસ્ય જાણવું અને તે મુજબ આચરણ કરીને વધુમાં વધુ માણ આપણામાં લેવાનો અને પચાવવાનો છે. કણો સૂર્યની ગરમીથી જ પરિપક્વ થાપ છે તેથી તે સૂર્યપ્રાણથી બરપૂર ખાવાથી તેમાંના સૂર્યપ્રાણને વધુમાં વધુ પ્રાપ્ત કરી શકાય છે. આવી રીતે કણો ખાઈને અમૃત સમય રહેવું તે પણ, અનંત ગાયત્રી-ઉપાસનાના પ્રકારોમાંનો એક પ્રકાર છે ગાયત્રી-ઉપાસનાના અનંત પ્રકારોમાંના કોઈ પણ એકનો સહારો લઈને, સૂર્યનારાયણ પણ જેમના નિયમનમાં રહેછે તે (નારાયણ)ની ઓળખ કરી લેવાની છે. આને દાઢાંતો, ચાલતા વિષયને સમજવામાં સહાયક છે તેથી આપણા.

સૂર્યનારાયણ કે સૂર્યભગવાન અંતું સંબોધન સૂર્ય માટે થાપ છે તે સાર્થક છે. તેઓ જ વિશ્વના જગતા અને પ્રત્યક્ષ દેવ છે. તેમને માનવાવાળામોમાં કોઈ અપવાદ નથી. તે સાકાર પણ છે અને નિરાકાર પણ છે. તેમના પ્રાણથી જ આપણો સૌ પ્રાણવાન છીએ. અસ્તુ.

આવા પ્રાણદાપક સૂર્યનારાયણ ભગવાન ચોમાસામાં વાદળોથી ઢંકાયેલા રહેછે. તેથી તેમનો પ્રાણપ્રવાહ અતિ અલ્ય માત્રામાં આપણા સુધી પહોંચે છે. તે કારણે આપણી પાચનશક્તિ મંદ થઈ જાય છે. મંદ પાચનશક્તિમાં હંમેશના કમ મુજબ બોજન પેટમાં પદ્ધતાવાથી જાડા, ઊલટી, મરડો, પેટપીડા વગેરે અસંખ્ય રોગો થાપ છે. આમાંથી અનાયાસે જ બચાવી લેવા માટે પરમદૃપાળું ઋષિ-મુનિઓએ-અનુભવીઓએ પુસ્તિ રચી. તેમણે શ્રાવણ માસમાં ઉપવાસ-એકટાણાં કરવાનો આદેશ આપ્યો - રિવાજ સ્થાપ્યો. આપણી જડ બુદ્ધિ વૈજ્ઞાનિક રહસ્યને જલદી ન સમજ શકે માટે તેઓએ કહું કે શ્રાવણ માસમાં - ચાતુર્ભાસમાં ઉપવાસ-એકટાણાં કરવાથી પુણ્ય થાપ અને તેથી સ્વર્ગ જવાપ અને તેમ ન કરવાથી પાપ થાપ અને નક્કે જવાપ. આરોગ્ય જગવાપ અને તેથી સુખશાંતિ રહેતે જ

પુષ્ય અને સ્વર્ગ; તથા રોગ માય અને તેથી દુઃખ-અશાંતિ આવી પડે એ જ પાપ અને નહીં.

કરુણાકરણે તો કરુણા કરીને સુખશાંતિ પ્રદાન કરવા પુષ્ટિપૂર્વકનાં સાધનો આપ્યાં, રસ્તા બતાવ્યા, પરંતુ આપજે બુદ્ધિશાળીઓ(૧)એ જ્યાં બુદ્ધિદોડવાની જોઈએ ત્યાં ન દોડવી અને ઉપવાસ-એકટાણાંમાં દોડવી ! ઉપવાસ તો કર્યા પણ ફલાહારથી નહીં પરંતુ બરકી, ગુલાબજાંબુ, રબડી અને શીંખડ ખાઈને કર્યા ! એકટાણાં તો કર્યાં પણ મંદ પાચનશક્તિને ઘાનમાં રાખીને પહેલા કરતાં અડયો અને શીંખ પચે એવો ખોરાક ખાઈને નહીં પરંતુ એકટાણામાં ચાર ટાકાંનો સીસા જેવો ભારે ખોરાક પેટમાં પદ્ધતાવીને કર્યા અને પાછી રાને તો “કરાળી” (ફલાહારી નહીં) ચીંઠે દ્વારાવવાની જ ! “ઉટ કર્યા દેકા તો માણસે કર્યા કાડા” ની જેમ અનુભવીઓએ રોગોમાંથી ભયાવવા પુષ્ટિ આપી તો પોતે માલ-મલીદા ખાઈને રોગોમાં સપડવાની બુદ્ધિ દોડવી !

આપણામાં પશુ-પક્ષી જેટલી પણ બુદ્ધિ નથી, પશુ-પક્ષીઓ પણ બીમાર અવસ્થામાં ખાવાપીવાનું છોડી દે છે, તેઓ અંતાંરણાને અનુસરે છે. આપણે બુદ્ધિશાળીઓ જ અંતાંરણાને ગંઠતા નથી તેથી મજબૂરીની છેલ્લી સ્વિતિએ પહોંચી જઈએ છીએ.

ચોમાસામાં ઘાસ ખાઈને ઊલટી કરતા કૂતરાને આપણામાંના ઘણાએ જોયું હશે, કૂતરું જિયારું પશુ છે. તે ચોમાસામાં એકટાનું કર્તૃ જોઈએ તે જાણતું નથી તેથી વધુ ખાઈ તો લે છે પરંતુ અસ્વસ્થતા જણાતાં જ ખાખેલો ખોરાક ઊલટી કરીને બહાર

કાઢી નાખે છે. ઊલટી કરવાનું તેનું અમોદ સાધન છે ઘાસ, ચોમાસામાં ઊગેલું લીલું લીલું ઘાસ તે ખાય છે અને પછી થોડી જ વારમાં ઊલટી કરીને પેટ ઉપર ગુજારેલ અત્યાચારની સજ્જમાંથી મુક્ત થાય છે. મનુષ્ય શું એક કૂતરા કરતાં પણ ઊતરતો છે ? અનુભવીઓએ તો કહે છે કે ધારે તો મનુષ્ય દેવ બની શકે છે. તો પછી મનુષ્ય શા માટે ધારતો નહીં હોય ?

શ્રાવણ એટલે શ્રવણ કર્તૃનું, શ્રાવણ માસ એટલે શ્રવણ કરવાનો માસ, અગિયાર માસ સુધી પેટ ઉપર અત્યાચાર કરી કરીને જે ઉપાર પાસું થયું હોય તેને શ્રાવણ માસના ઉપવાસ-એકટાણાંથી જેમ જમાપાસામાં પલટાવી નાખીએ છીએ તેમ અગિયાર માસ સુધી કે અથોર્ય અને અકલ્યાશકારી સાંબળી સાંબળીને જમા પાસામાં ફેરવી નાખવાનું છે. અન્ન સ્ફૂળ આહાર છે અને શ્રવણ સૂક્ષ્મ આહાર છે, આ નંને આહાર વિના મનુષ્યને ચાલે નહીં. શ્રાવણ માસમાં એટલું જમા કરી લેવાનું છે કે ગયા વર્ષના અગિયાર માસમાં ઘેલું ઉધાર જમા થાય અને આવતા વર્ષના અગિયાર માસ માટે પણ આગળથી જમા થાય, તેમ છતાં જે ઉધાર થાય તે વર્ષમાં આવતાં બીજાં ઉપવાસ-એકટાણાં અને સત્સંગ-વાર્તા દ્વારા જમા કરતા જવાનું છે.

આ રીતે શ્રાવણ માસમાં સાચાં ઉપવાસ-એકટાણાં કરીને પેટનો અને અણસમજનો કચરો કાઢીને પુષ્ય ગ્રામ કરીને સુખ-શાંતિ અને આરોગ્યના સર્વર્થને મેળવી લેવાનો પ્રયત્ન કરવાનો છે.

પરમાલા સૌને સાચાં ઉપવાસ-એકટાણાં કરવાની સમજ અને શક્તિ આપો તેવી પ્રાર્થના.

“ભગવાનનો ક્રયારેય મોક્ષ નથી થતો કારણકે તે શાસનમાં નથી રહેતા, સ્વાંદ વર્તન કરે છે, બક્તોનો મોક્ષ થાય છે કારણ કે તેઓ શાસનમાં રહે છે, નિયમમાં રહે છે.”

“અનુભૂતિ છે ત્યાં અસ્તિત્વ છે, અસ્તિત્વ છે ત્યાં આકાર છે, સ્ફૂળ આકાર અને દિવ્ય અલોકિક આકાર, અલોકિક આકારનું નામ જ નિરાકાર.”

“અભય કયારે થવાય કે જ્યારે બીજાઓ આપણાથી અભય પામે, જેવું વાવીએ તેવું લણીએ, અભય વાવીએ તો અભય લણીએ-પામીએ, જ્યાં સુધી આપણાથી અન્ય કોઈ ભય પામતું હોય ત્યાં સુધી આપજે અભય કયાંથી થઈ શકીએ !”

जीश्वर का बोधक (नाम) प्रणव/ओम है।



(यात्रिकार के द्वारा द्वा. यात्रिकार)

- (२४) कलेज, कर्म, कर्मसुल और वासना जिसमें नहीं है ऐसा पुरुषविशेष/वेतनविशेष जीश्वर है।
- (२५) आधर संगूर्ण सर्वह है।
- (२६) आधर पूर्वकाल के गुरुओं के भी गुरु है और काल की मर्यादा से (जन्म-मृत्यु से) पर है।
- (२७) आधर का नाम प्रणव/ओम है।
- (२८) अर्थ के चिन्तन सहित ओम् का जप करता।
- (२९) चिन्तन सहित जप करने से बालगणों का अभाव नहीं आत्मसाक्षात्कार होता है।

प्राप्तिकार ऑफिस, १०८, चौकीपाल, काशीगुरु, उत्तराखण्ड-२४७००३१।

● द्रष्टव्या उद्देशी :-

- (१) सर्वव्यापक परम सूक्ष्म चेतन तत्त्व के जेतुं नाम अणुव (योम्-॒॑) छे तेनी प्रतीति भगुज्जनसमाजने कराववा प्रथत्त करवेहा। (२) 'योग'नो प्रचार, प्रसार अने भुंशेधन करवा प्रथत्त करवेहा। (३) भगुज्जन्तु' नेतिः धैरणु उंचुं द्वाववा भाटे आध्यात्मिक ज्ञाननो साहित्य ढारा प्रचार अने प्रसार करवानो प्रथत्त करवेहा। (४) आ उपरांत 'भगुज्जनहिताय-भगुज्जनसुखाय'ने लगतां कार्यो जेवां के डेणवधी, तथीछी सारवार वजेरे करवा भाटे प्रथत्त करवेहा।

PRINTED BOOK
Registrar of News Papers of India under Regd. No. 4877090



આધ્યાત્મિક સૂચિ

અધ્યાત્મિક લક્ષ્ણ તથા

ગુરુદેવ શ્રી ચોગલિલુલુ

To,

ગુરુદેવ શ્રી ચોગલિલુલુ

PRINTED & PUBLISHED BY :-

Dr. S. S. Bhikshu for

AUMGURU PREMSAMARPANDHYANBHIKSHU PARIVAR TRUST

1/A, Palladnagar Society, Naranpura, Ahmedabad - 380 013.

Hon. Editor : Naishadh C. Vyas

{ (Reg. No. E/4416 Date 11-5-81)
I.T.E.U.80-9 (5) No. H Q-III 33-163/92 93 Up to March 1995 }

લખાજમ દર : -

વાર્ષિક સભ્ય (ભારતમાં)	રૂ. ૧૨-૦૦
આજુવન સભ્ય "	રૂ. ૨૫૦-૦૦
વાર્ષિક સભ્ય (પરદેશમાં)	૧૨ ડોલર
આજુવન સભ્ય "	૨૫૦ ડોલર

લખાજમ મોકલવાનું સ્થળ *

(૧) ડૉ. સોમાભાઈ એ. પટેલ
૧/અ, પલિયનગર,
સેન્ટ કેવિયર્સ હાઇસ્ક્વુલ રોડ,
નારણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.

(૨) નેપથ્બાઈ સ્ટી. વ્યાસ
“સ્વાત્રય”
૩, ગંગાધર સોસાયટી, રામભાગ પાછળ,
મહેનગર, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

* સૂચના *

(૧) લખાજમ ચેક ક્રાશ અથવા મનીઓડ્ર
ક્રાશ “એ. એ. પ. ટ્રસ્ટ” ના નામે,
મોકલવું. સાથે આપણું પૂર્કું નામ
સરનામું શુદ્ધ અક્ષરામાં લખી મોકલવું.

(૨) જે સભ્યનાં રહેઠાણુનાં સ્થળ બદલાયાં
છોય તેમણે તેમના નવા રહેઠાણનું પૂર્કું
સરનામું લખી મોકલવું જેથી વ્યવસ્થા-
પકોને અંક મોકલવામાં સરળતા રહે.

(૩) “નેપથ્બાઈ” ને લગતો પત્રવહાર
નીચેના સરનામે કરવો.

નેપથ્બાઈ સ્ટી. વ્યાસ
“સ્વાત્રય”

૩, ગંગાધર સોસાયટી, રામભાગ પાછળ,
મહેનગર, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

પ. પુ. શુકુદેવ શ્રી ચોગલિલુલુ સાથેનાં
સંસ્મરણો તથા પ્રેરક પ્રસંગો આવકાયો છે.

Pin Code

--	--	--	--	--	--